

શ્રી સુધર્માસ્વામી ગ્યાનબંદર

ગ્યાનબંદર  
અસ્ત્રોદાર, સાલાના  
સુરત - ૩૮૦૦૮૮૭  
કેન્દ્રાધિકાર : ૦૨૮-૨૪૨૪૮૦૦૩



## પ્રસ્તાવના

ભાઈશ્રી અમરચંદ્ર માવળું શાહનાં “ અલયદાનના અનુભવો ” ના નાચ પ્રકાશનને વાસ્તવિક રીતે પ્રસ્તાવનાની આવશ્યકતા ન હોય. કોઈપણ વ્યક્તિનું ચરિત્ર કે, જીવનના વિશિષ્ટ બનાવો, એ ગોતેજ તેમના જીવનની પ્રસ્તાવના કે અનુક્રમણિકા છે. છતાં દેખકે વણું વેલા અલયદાનના અનેક પ્રસંગની સાથે જીવદ્યા મંડળીની વતી હું નિમિત્ત હોઈ, તેમની વિશિષ્ટતા તરફ વાંચકેનું લક્ષ બેંચવા માટે પ્રસ્તાવના લખવા હું પ્રેરાયો છું.

ભાઈશ્રી અમરચંદ્ર માવળું શાહ એક ધર્મપ્રિય જૈન હોવા છતાં જણ્યે અભાણ્યે તેમની અહિંસા પ્રિયતાની કસોટી, તેમણે જીવનના પ્રારંભમાં સ્વીકારેલી નોકરી દ્વારા થઈ, એમ કહેવું એ વાસ્તવિકતા છે. તેમના હૃદયમાં અહિંસા ઓતપ્રોત થયેલી હોઈ, તેમના કસોટી કાળમાં પણ તેમની અહિંસા પ્રિયતાએ વર્ણસ્વ મેળવ્યું. તેમની એ ભાવનાએ તેમના શોઠના માનસપર પણ અસર કરી, અને તેઓ નોકરીના સમય દરમ્યાન અલયદાનનો પ્રથંધ કરી, પોતાના આત્માને અચાવી શક્યા. પરિણામે ત્યારપછીનો તેમના જીવનમાં અહિંસાને વધારે વિકસાવવાનો સુચોંગ તેમને પ્રાપ્ત થયો.

સુંભાઈ જીવદ્યા મંડળીની સાથેના તેમના સંખંધ દરમ્યાન પણ તેમણે હંમેશા સિધ્ધાંતને સ્વાથે કરતા વધારે ઉચ્ચ માનીને સંપૂર્ણ કર્ત્તાંય નિષ્ઠાથી જીવદ્યાનો પ્રચાર અને અલયદાનના અનેક કાર્યો કર્યો છે, તે તેમની વિશેષતા છે. તેમની એ નિર્મણ અહિંસા પ્રિયતાએ તેમના આત્માને અધિક વિકસાવી ધર્મની અનેક સાધનામાં પ્રેરોધી છે.

તેમણે પુસ્તકમાં વર્ણવેલ અભયદાનના અનુભવો એ તેમની મોટાઈ વધારવાના કરતાં અહિંસક સમાજને પ્રેરણા આપે એ હેતુથી પ્રગટ કરવામાં આવ્યા હોય એમ હું માનું છું.

આજે જ્યારે અહિંસક સમાજમાં પણ સિદ્ધાંતની સક્કીયતામાં શિથિલતા આવતી જાય છે, ત્યારે ભાઈશ્રી અમરચંદ માવળું શાહુનો અભયદાનનો ઇતિહાસ પ્રેરણા આપે એજ હું ઈચ્છું છું.

૧૪૬ શારાકુખજાર  
સુંબદ્રી ૨  
તા ૬-૪-૬૫

જ્યન્તિલાલ એન. માનકર  
માનદૂમંત્રી  
સુંબદ્રનીશ્રી લુલદ્યા મંડળી

સ્વ. દ્યાલંકાર પૂજ્ય પિતાતુલ્ય  
શેઠ લલ્દુલાઈ દીપચંદ જુવેરી

અમરસમણ્ણોજલી

જેણે વિતાંયું લુલન જગમાં, લુલદ્યાના કાર્યમાં;  
જેણે વહાંયું દાન જરણું, સુક લુલ ખચાવમાં.  
જેણે દીપાંયું વીરતણું, એ સૂત્ર અહિંસા ધર્મનું;  
ચુગ ચુગ એ ‘અમર’ રહે, પ્રતિક લલ્દુલાઈનું.

આપનો ખાળ અમરચંદ  
ના વંન

# સ્વ. પૂજય પિતાશી



૦૮૮૮

સંવત ૧૯૨૮  
આધ્યાત્મિક સુધી ૧૦  
વિજ્ઞાનશાસ્ત્ર  
પચ્છેગામ

સ્વર્ગવાસ

સંવત ૨૦૦૩  
ભાડ્યાદ્યાદ  
બીજાપુર  
( કર્ણાટક )

## શાહ માવળ ગાંગળ

પૂજય પિતાશી,

આપનો લાગણીપ્રધાન સ્વભાવ, આપની સરળતા, આપની દુઃખીઓ પ્રત્યેની કરણાભાવના, ધાર્મિકવૃત્તિ, આહિ આપનાં સદ્ગુણો મારો ઠોંભતી વારસો છે. આપે ૫૦ વરસતી ઉંમરે પચ્છેગામમાં કાપડની દુકાન બંધ કરી મુંખી જઈ નોકરી કરી આખા કુદુંખને ઉગારી દીધું. મને પાદીતાણા ગુરુકુલમાં ભણ્ણાવ્યો, મને લાઇને ચડાવ્યો. આપે ધણા દુઃખ સહન કર્યા આપનાં ઉપકારનો બદલો વાળવા અસમર્થ છું. આપે છેલ્લું વૃદ્ધાવસ્થાનું જીવન ભાઈ દીયાંહનાં સાનિધ્યમાં કર્ણાટક બીજાપુરમાં સુખ શાંતિપૂર્વક વિતાવી ત્યાંજ આપ હેવગત થયા. આપના અંતિમ દર્શન સંવત ૨૦૦૩ માં બીજાપુરમાં થયા. આપનાં આશિર્વાદ પ્રાપ્ત કર્યો. આપની પુન્યસ્મૃતિ આ બુકમાં પ્રકાસીત કરી કૃતાર્થતા અનુભવું છું.

આપનો બાળ  
અમરયાંહના વંદન

# સ્વ. પૂજય માતુશ્રી

૭૧૮

સંવત ૧૯૩૮  
સિહેલ (સૌરાષ્ટ્ર)



સ્વર્ગવાસ

આશ્રિત વદી ૧૪,  
સંવત ૨૦૨૦  
બીજપુર (કર્ણાટક)

## દ્વાચલખાઈ

પૂજય માતુશ્રી,

આપના સાનિધ્યમાં એ માસ અમો રણાં. ધર્મઆરાધના કરાવી,  
આપનાં દર્શન કરી કૃતાર્થંતા અનુભવી. આપનો શુવનદીપ ખુજાવાની તૈયારી  
હતી, પરંતુ અમારી ધીરજ ખુટી અને અમો તળાજ આવ્યા. અને ૨૫  
દિવસે આપ સ્વર્ગવાસી થયા, આપનો અદ્ય સમય માટે વિયોગ થયો. મારા  
પૂજય પિતાશ્રી સંવત ૨૦૦૪નાં ભાદ્રવા વદી હનાં બીજપુરમાં સ્વર્ગવાસી  
થયા. આપ પણ બીજપુરમાં લઘુઅંધુ દ્વાચલખાઈના ત્યા અ. સૌ. સુરજ.  
લક્ષ્મીના સાનિધ્યમાં વૃક્ષાવસ્થા શાંતિપૂર્વક વિતાવી વિદ્યાય થયા. અખંડ  
બહેણું કુટુંબ, લીલીવાડી મૂકીને ગયા. આપના આશીર્વાદથી આખું  
કુટુંબ સુખી છે. આપનાં પૂજય આત્માને અમારી વંદના.

આપના ખાળ

અમરચંદ તથા અ. સૌ. સૌલાગ્યના વંદના

## અમર વંદ્ના

જેના દીલમાં નિત્ય વહેતા,  
જેનાં ઉરમાં નિત્ય વરે,  
જેની ગોદમાં લાડ કરીને,  
માતા તમારા ઉપકારો,  
માતા તમારા સંસ્કારો,  
ધ મેં પંથે જીવન જીવવા,

ત્રાસીવરસે ‘બીજાપુર’માં,  
લીલીવાડી નિરખી નથને,  
દીપોત્સવીનાં મંગળ દીવસે,  
સંવત એ હજ ર વી શે,  
સેવા કરી દલીચંદભાઈએ,  
સકળ કુદુંઘે લાવનાથી,  
અંતિમ દર્શન, પચુંખણુમાં,  
વંદન કરી ‘અમર સૌભાગ્ય’,

સમતા પૂર્વક સહન કરીને,  
વિચોગી ‘અમર’ કરે છે,

તળાજી (સૌરાષ્ટ્ર)

દીપોત્સવીદીન સં-૨૦૨૦

વાત્સ દ્વયા મૃત અર ણું,  
આશિ વો દ અનંતા,

ઉછાંયો આનંદ કરતા,  
સંભારતા અશ્રુ વહેતા,  
વાર સેં છે અમારો,  
આય નો એક સહારો.

આપ સવ જો સિધાવ્યા,  
સંતોષ દીલમાં વહાંયા,  
મૃત્યુ મહોત્સવ બનાંયું,  
સમાધી ટાણું આંયું.

માતુલ કિતા દિપા વી;  
કર જ પૂર્ણ બજા વી,  
કરી કૃતા થો થધયા;  
આશિષ લઇ નિકળીયા,

વૃધા વસ્થા વિતા વી;  
વંદના શિર ન માવી,

આપનોભાગ  
અમરચંદ્ના વંદન

## બા ગયા

વડિલ ભાઈશ્રી તથા ભાભીશ્રીની સેવામાં, ... સુ. તળાજા

બા ગયા ! આજે સવારના જ વાગે ધણી જ શાતા પૂર્વક પૂજય માતુશ્રીનો દેહ વિલય થયો ! ધણું વરસોથી સાથે જ હતા, જેથી મોહ અને માયાને અંગે ધણું જ હુઃખ લાગ્યું. પૂજય માતુશ્રીની ઘોટ બહુ જ સાલે છે; દીવાનખાતું સુનકાર લાગે છે, ૨૦ વરસની જગ્યા એક દિવસમાં ખાલી ખમ થઈ ગઈ છે. તેમની દરેક વસ્તુઓને જોતાં જ સંસ્કરણો થઈ આવે છે; અને ગણે હુમે ભરાઈ આવે છે, હૈયું કઢણું રાખવા ડોશિષ કરું છું, પણ માતુશ્રીનો સ્નેહ અને તેમનો પ્રભાવ એવો હતો કે, વિસરાય તેમ નથી.

બહુ જ મોભાસર જીવન જીવ્યા. ૮૩ વર્ષમાં ડોઈએ પણ તેમનું વચ્ચે ઉથાપું નથી. જીવનમાં ડોઈને પણ કડવો શાખદ કલ્યો હોય તેવું મને યાદ નથી. અતે ૨૦ વરસમાં ડોઈપણ દિવસ આકરા થયા હોય તેવું બન્યું નથી. ડોઈપણ સંજેગોમાં તેમણે કુદુંઘને જે સંસ્કારો આપી અત્યારે જે આબાદી સૌ જોઈ રહ્યું છે, તે તેમનો જ પ્રતાપ છે.

માતુશ્રી જતાં પુછવા ડેકાણું ચાલ્યું ગયું, જાણે આપો યુગ અદ્દલાયો, ૨૦૨૦ માં માતુશ્રી હતા, ૨૦૨૧ માં માતુશ્રી નથી. ગયા વરસે મારા મુખમાંથી ઉદ્ગારો નીકળી પડ્યા હતાં કે, “૨૦૨૧માં પૂજય માતુશ્રી નહીં હોય” એવું જ જની ગયું છે, જેવી પ્રભુ ઘર્યા ! હવે તો તેમની કુખ્યને ઉજણનારા તેનાં પૂત્રો-પ્રપૂત્રોએ તેમનાં અમર આત્માને જ્યાં હોય તાં શાંતિ ભજો તે રીતે જીવન જીવવાનું છે.

તમો બન્ને યોગ્ય ટાઈમિસર અતે આની ગયા જેથી પૂજય માતુશ્રી ધર્મા જ ધર્મ પામી ગયા છે. ડોઈની મૃત્યુ તિથી યાદ રહી નથી. પૂજય માતુશ્રીનો મૃત્યુ દિવસ આખા જીવન પર્યાત યાદ રહેશે.

તા. ૩-૧૧-૬૪

ભીજપુર (કર્ણાટક)

લધુઅંધુ

દ્વીપંદ્ના વંદન

## સ્વ. વહિલભાઈ



૦૪-મ

સંવત ૧૯૪૬  
પંછેગામ

નવર્ગ વાસ  
સંવત ૨૦૦૪  
ભાડપદ વદી ૩

### શાહ પુરુષોત્તમદાસ હીયાળ ગાંગજ

વડીલ ભાઈશ્રી,


તમારા વરદાર મોરા, સ્પષ્ટ અને સચોટ વાણી, વ્યવદાર કુશળતા,  
પરગજુંપણું પ્રેરણુંતુંક ૫તું. તમો તમારા કાકાશી માવજુભાઈનાં  
સાનિધ્યમાં સો ઉછ્વાસ. તમારા લગ્ન સિહેર અ. સૌ. અંજવાળીબાઈ સાથે  
થયા. સુખદુઃખનાં દંડ વચ્ચે પસાર થયા. તમારા ચી. દીપયંદ ચી.  
અમૃતલાલ ચી. વિનયચંહની ત્રિપુરીએ તમારા કુટુંબનો લાર ઉપાડી લીધો.  
મુંઘઠમાં લાઠને ચડી ગયા. એ સુખનાં દ્વિસો જોવા તમો રોકાયા નહીં.  
અને પરલોક પ્રયાણ કર્યું. પૂત્રો ધર્મિષ્ટ થયા. પંછેગામમાં દહેરાસરમાં  
તેઓએ માતા પિતાનાં શ્રેયાર્થ પ્રતિમા સં. ૨૦૧૭ માં પધરાતી, પ્રતિધા  
કરી. તમારું પ્રતિક આ ઝુકમાં પ્રકાશિત કરી, અંજલી અર્પું છું.

તાંગાજ

આપનો લદ્યુંધું

અમરચંદ માવજ શાહ

# સ્વ. વડિલભાઈ



૦૮૮૮

સંવત ૧૯૫૯  
પદ્મચોગામ

અવાર્ગવાસ

સંવત ૨૦૧૦  
વૈશાખ શુક્ર ૬

શ્રી પાણુલાલ માવજી શાહ

વડીલ ભાઈશી,

તમે પદ્મચોગામમાં 'રહી બહુ મોલાસર વરપૂર્વક' જીવન જીવ્યા.  
નિષ્કર્પદી છદ્ય અને પરગજુ સ્વભાવ 'સાચું એવાવું' ને નિતીથી ચાલવું  
આ એ જીવનવૃત્તોને જીવનપર્યાત સાચવી, માત્ર પર વર્ત્તની ઉંમરે વન  
પ્રવેશનાં વર્ત્તમાં આપે ગી. જ્યંતીલાલ ગી. ધીરજલાલ પાસે કર્ણોટકમાં  
બાગલકોટ જીવાની તૈયારી કરી તાં આપે પરલોાં પ્રયાણ કર્યું. ભાઈ  
દ્વારાચંદ્ર અંતિમ સમયે આવી પહોંચ્યો. હું તળાજન પ્રતિષ્ઠામાં રોકાયો  
ક્રતો, આપે મને ખ્યાર ન આપ્યા, આપનો સહાનો વિશેષ રખ્યો. માતુશ્રી  
બીજાપુરમાં જુરતા રહ્યા. આપનું પ્રતિક આ મુસ્તકમાં પ્રકાશિત કરીને  
ગુંજવી આપું છું. તમારા આત્માની પરમ શાંતિ ઈચ્છુ છું.

વિશેષજી લઘુઅંધુ અમરચંદ

## પૂજય માળની યાદ

મમતા ભર્યું સુખ્ખું માડી, પાદ આવે છે અપાર,  
માડી તમારા વિયોગે ઝુરે, ધરમાં સૌ નરનાર;  
હતા સહું સુખમાં માડી, તમારી સેવા માંડી...૧

પચ્છેગામમાં પૂજય પિતાશ્રી, કામહાર પોપટલાલ સાથ,  
રલ્લા માડી તમે વરસો સુધી, સૌની લઈ સંભાળ;  
તમારી હુંકેમાં માડી, વધી રહી લીલી વાડી...૨

કાકા અમરથંદ તળાણ તીર્થે, કરવા આત્મ કલ્યાણ,  
આશિષ લઈ આપનાં માડી, કાકી સૌભાગ્યની સાથ;  
તીર્થની સેવા કાજે, તાલધ્વજ તીર્થે બિરાજે...૩

કણ્ણુંટકના બીજાપુર શહેરમાં, હલીથંડ કાકા નિવાસ,  
સાયકલની હુકાન કરીને, કુદુંઘનો કચો ઉદ્ઘાર;  
તમારા આશિષે માડી, કરી ધણી ગ્રભતી સારી...૪

સૌરાષ્ટ્રમાંથા માળ બીજાપુર, જયંતીલાલની સાથ,  
દાદાને લઈ ધીરજ આવ્યો, અપૂર્ણ કરી અભ્યાસ;  
કાકાની ભાવના ભારી, સેવા માતાપિતાની સારી...૫

એ હળર ચારે દાદા અધ્યાને, એ હળર વીરો મા,  
કણ્ણુંટકનાં બીજાપુરમાં, લીધી સમાધી ત્યાં;  
દીવાળીને દીવસે માડી, યાદગીસી મહાન રાખો....૬

ખાગલકેટ ગુલાયરબા રાયચુર વણું ગામ,  
શાહ સાયકલની શાખા ચાલે સુખી છે તમામ;  
તમારા આશિષે માડી, ચાલુ થઈ અમારી માડી...૭

કંચન ઈચ્છને વિયોગ રલ્લો, આપે લીધી વિદ્ધાય,  
માતા ગુલાયરને સુરજ કાકી, કુદુંઘ સાનિધ્યમાંય;  
ધીરજની વંદના માળ, સ્વિકારનો થઈને રાળ...૮

આપનો ખાળ

ધીરજલાલ પોપટલાલ શાહ  
ના વંદન

ગુલાયરી (મૈસુરરસ્ટેટ)  
તા. ૩-૧૧-૧૪

## આતમ નિવેદન

અરમ તિર્થીકર શ્રી મહાનીર સ્વામીએ સ્થાપેલ જૈન શાસન અને એ ધર્મનો અનુયાયી હું એ મહાન પ્રભુની આજાને અને એમના કહેલા ધર્મને અનુસરનાર એમણે કથેલા મહા વૃતોમાં પ્રથમ વૃત 'અહિસા'ને હું મન-વચન-કાયાથી પાળવા અને દુનિયાના સર્વ જીવો પ્રત્યે પ્રેમભાવથી રહેવા ધર્યાનાર તેમજ જીવોને 'અભયદાન' મળે તેવો પુરુષાર્થ કરનાર અને જગત જીવોનો સેવક થઈ સેવા કરનાર આત્મા છું.

દુનિયામાં જીવો જે નિર્દ્યપણે કરતાથી પાપીજનોનાં હાથે હણુાય છે, જે દુઃખી છે, તે સર્વ પ્રત્યે મારી હીલસપક્ષી સહાતુભૂતિ છે અને દરેક જીવો દુઃખમુક્ત થાય એવી મારી હુંમેશા આવતા છે. એમા જેટલો આત્મભોગ અપાય, તેટલો આપવા હું હુંમેશા તૈયાર છું.

હાલમાં માર્દ કાર્યક્ષેત્ર હું એક વિષયમાં રહી, ક્ષેત્રવાડ બાંધી, એનો પાછળ મંડી રહી એમાં વિજય પ્રાપ્ત કરવા ચાહુ છું. વહેચણીની પ્રક્રિયે હુંમેશા કાર્ય સુંદર અને સંગીત થાય છે, એમ માર્દ માનવું છે, એટલે માર્દ કાર્યક્ષેત્ર મેં જ મારા અનુભવે જ સિક્ક થયું છે, તેની પાછળ સતત મહેનત કરવા માંગુ છું.

મુંખું શહેરમાં દુધ માટે આવતા ગાયો લેંસો જે વસુકી ગયા બાદ કતલખાને વેચાઈ કતલ થાય છે, તેના કુમળા બચ્ચાઓ લુંપે તરસે રીખાઈ મરણ પામે છે, આ મુંગા અણોલ અને જનદિતકારી પથુંએ કે જેના ઉપર માનવ પ્રાણીના જીવન મરણનો આધાર છે તેવા દ્વિઅર્થી જીવનદ્યાના કાર્યમાં એ જીવોને અભયદાન અપાવી માનવ સમાજનું અને પ્રાણીઓનું રક્ષણ કરવા તન-મન-ધતથી, મન-વચન-કાયાથી,

લમથી, જીબથી, હાથથી, પગથી, જે રીતે સેવા થાય તે રીતે કરીને, રોનો બચાવ કરવા ધર્તિકંચીત પ્રયત્ન કરવો અને તે માર્ગમાં જે કાંઈ છે ઉપસ્થિત થાય તે મુંગે મેઢે સહન કરવું, લોડોપવાદ સહન કરવો, અને શાંતિના માર્ગ આ પ્રશ્નનો ઉકેલ કરાવવો.

જીવદ્યાનો પ્રશ્ન વિશાળ છે, વ્યાપક છે, છતાં તેના એક વિભાગ તરીકે આ ક્ષેત્રમાં રહી, અનતો પ્રયત્ન કરવો આ માર્દ હાલ તુરતનું કાર્યક્ષેત્ર છે, છતાં દુનિયાનાં દરેક જીવો ઉપર સમાનભાવ છે, દરેક જીવનો બચાવ થાય એવું ધૂચ્છુ છું, એ જ મારી રાત્રિ દ્વિવસ ભાવના છે.

એ ભાવનામાં હું ઇલીકૃત થાઉં, એવું પ્રાણદ્ય મેળવું, આ કાર્યમાં જે જે તકે મને સેવા નિમિત્તે મળે તેનો એક ક્ષાણું પણું પ્રમાદ કર્યાં સિવાય સદ્ગુપ્ત્યોગ કરું અને એ રીતે મારા જૈન ધર્મી જીવનને સાર્થક બનાવું, અને જીવદ્યાની જ્યોતા જગવતો છતો જીવનની છેક્ષણ પળ સુધી એ જ ભાવનાથી વિરમું એ જ મારા જીવનની સાર્થકતા એજ મારા માનવ જીવનનું અમૂલ્ય કર્તવ્ય.

મુંદુક

તા. ૩-૫-૧૬૩૬

અમરથંડ માવળ શાહ

પદ્ધતેગામ નિવાસી.

આ આત્મ નિવેદન મારા જીવદ્યા-ગોસેવા અગેના લેખો કાવ્યો વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થતા હતા તેની નકલોની મેં એક મોટી ફાઈલ બનાવેલી તેનાં શરૂઆતના પૃષ્ઠ પર આ લખાણું મેં સંવત ૧૯૬૨માં લખેલું તે આ ‘અભયદાનના અનુભવો’નાં પ્રકાશન સમયે તે વખતની ભાવના દર્શાવી કરું છું.

અમરથંડ

“ મનુષ્યના અંતરમાં કાઈ ધન્ય પળે શુલ્સ સંકદ્વય જાગે અને એ સંકદ્વયને પરિપૂર્ણ કરવા એ સર્કિય અને તો એને જરૂરી સહાય મળતી જ રહે છે.

સાવ પ્રતિકુલ સંયોગો વચ્ચે પણ એનો કર્તવ્ય દીપ અગારા મારી રહે છે. ‘ જીવદ્યા ’ને ક્ષેત્રે શ્રી અમરચંદ માવળ શાહનું સમર્પણ પણ આવું જ ઉજ્જવળ અને પ્રેરક છે. તેમના જીવનના આ પાવનપ્રસંગો કરુણાજળ સૌચશે અને મુંગા પ્રાણીએ માટે કાંઈને કાંઈ કરી છુટવાની ભાવના જગાડી જશે.”

રાજકોટ

મે ૧૯૬૬ અંકમાંથી

તંત્રીશ્રી “ પરમાર્થ ” માસિક  
જયહિંદ કાર્યાલય

‘ અભયહાનના અનુભવો ’ એ શિર્ષક તંત્રીશ્રીએ પરમાર્થ માસિકના મે-જુન ૧૯૬૬નાં અંકમાં એ હપ્તે છપાયા છે, તેની ઉપર સુર તંત્રીશ્રીએ ઉપરોક્ત નોંધ લખી મને આભારી જનાર્થો છે. તે બદ્લ તેઓશ્રાનો હાઈક આભાર માતું છું. શ્રી જ્યાંતિલાઈ શાહ રાજકોટમાં જીવદ્યાનું ત્યા વિશ્વપરિવારની સેવાનું જે ધગશપૂર્વક કાર્ય કરી રહ્યા છે, તે અભિ-  
નંદનિય અને અતુમોહનિય છે. વર્તમાનમાં જીવહિંસા એટલી બધી વધી છે કે જેનાં પરિણામે ભારતમાં દુધ-ધીનાં દુકાળ પણ છે, વેળુટેખલ ધી ખાવાનો સમય આંગ્રો છે, રોગો વધવા લાગ્યા છે. ઐતીવાડીમાં ખળહોની બેંચ પડી છે—અતાજની તંગી થઈ છે જ્યાં સુધી ઐતી-  
ઘેડુત-ગાય અને ગોવાળનાં ચાર પાયા મજબૂત નહિં થાપ ત્યાં સુધી ભારતનો ઉદ્ધાર નથી.

—અમરચંદ



અમરસ્વામી શાહ

૦૮-૮

તૃતીયવનપ્રવેશ

સં. ૧૯૬૫ માટે શુદ્ધ

સં. ૨૦૨૧ માટે શુદ્ધ

પરછિગામ

તળાજ



અ. સૌ. સૌભાગ્ય અમરચંદ શાહ

૧૪-૮

સ. ૧૯૭૦ માટે શુદ્ધ ૭

મહુવા

વનપ્રવેશ

સ. ૨૦૨૩ માટે શુદ્ધ ૭

તળાના

॥ અહિંસા પરમોધર્મઃ ॥

# અમર લુવદ્યા સાધના

( અભયદાનનાં અનુભવે )

પારેવાને અભય હુએચું, શાંતિનાથ જિનેશ્વરમ  
મુંગા મૃગોને અભય આપ્યું, નેમનાથ જિનેશ્વરમ  
બળતો નાગ બચાવીયો, શ્રી પાર્વનાથ જિનેશ્વરમ  
લુવદ્યાની જ્યોત જગવી, નમું વીર જિનેશ્વરમ

વિતરાગ જિનલગવંતોચે, લુવદ્યાને પરમધર્મ કહ્યો  
છે, તે તેઓ શ્રીએ પોતાનાં લુવનમાં આચરી જગતને  
“અહિંસા પરમોધર્મઃ” નો સંદેશો આપ્યો છે. એ સંદેશને  
શીલી અનંત લભ્ય આત્માચો લુવનમુક્તા થયા છે, જાંસારનાં  
ત્રિવીધ તાપથી શાંતિ પામ્યા છે. એ જિનેશ્વરોત્તું સમરણ  
કરીને એ વીતરાગ માગેની આરાધના માટે ઉત્તમ એવી  
મનુષ્યગતિ, જૈનકૃષ્ણ, આર્થિકોત્ત્ર, સહૃદાય, સત્ત્ર દેવ, સત્ત  
ધર્મની પ્રાપ્તિ થઈ. તેનો સહૃદિપયોગ કરવાત્તું પૂર્વપુન્યોદ્યથી  
સાંપડયું, તે નિમિત્તો કેવા કેવા સંજોગોઅં સાંપડ્યા; તે  
તકોને વધાવી લઈ તેમાં લુવોને અભયદાન અંગે લુવદ્યા  
પ્રવૃત્તિનાં અનુભવે થયા છે, તે પ્રેરણાત્મક અને રસપ્રદ અને  
તે માટે થોડી આત્મકાધાનો ઢાખ વહેારી લઈને લુવ-  
નીકાનાં સ્વરૂપમાં રજુ કરું છું.

જૈન ધર્મી તો તેને કહીયે, જે લુવદ્યા પ્રત પાણે રે;  
સુકલલુવને આત્મસ્વરૂપે, નિરભી નયનને ઢાણે રે.

મારો જન્મ સંવત ૧૯૬૫ મહા સુદ ઉનાં રોજ સૌરાષ્ટ્રમાં વલ્લભીપુર પાસેનાં ઘેલા નદીનાં કીનારે દેશીવૈઘો અને આરોગ્યપ્રદ આંખોહવાવાળા પરછીગામમાં થયો હતો. મારા પિતા શ્રીતું નામ માવળુલાઈ ગાંગળુલાઈ, મારા માતુશ્રીતું નામ ટખલખાઈ, મારે એક વહીલલાઈ પોષટલાલ અને એક લધુ બંધુ દલીયંદ અને લધુફળેન કંચનખેન. હું વચેટ પુત્ર. મારું નામ અમરચંદ.

સાત વરસની ઉંમરે તાલુકાસુલમાં દાખલ થયો. પાંચ ગુજરાતીનો અલ્યાસ કર્યો. ધાર્મિક અલ્યાસ પાઠશાળામાં કર્યો. ૧૨ વરસની ઉંમરે સંવત ૧૯૭૭માં હું પાલીતાણુભામાં શ્રી યશોવિજયજી નૈન ગુરુકુળમાં વધુ અલ્યાસ માટે દાખલ થયો. ત્યાં મને સનિમિત્ર પૂજય શ્રી કર્પુરવિજયજી મહારાજનો સત્તસમાગમ પ્રાપ્ત થયો, ધાર્મિકસંસ્કારોતું ધીજરોપણુથ યું.

સંવત ૧૯૮૧માં હું સાત ગુજરાતી અને સાડા ત્રણ અંગ્રેજનો અલ્યાસ કરી, યોગ અધ્યાત્મમાં અલ્યાસ માટે પાટણ નૈન બોડીંગમાં પૂજય ગુરુદેવની આજાથી જવા માટે ગુરુકુલમાંથી રજ લઈ સ્વવત્તન અયો. માતાપિતાની સ્થિતી સાધારણ હતી. પિતાશ્રી મુંખાઈ નોકરી કરતા હતા. પૂજય માતુશ્રીએ પાટણ જવાની આજા આપી નહીં અને ધંધાની ધુંસરીએ પલોટાઈ કુટુંખની ઝરણ અદા કરવા ઝરમાંયું. ૧૯૮૧ થી ૮૫ સુધી ત્રણ વરસમાં અનેક નોકરીઓમાં નોડાઈ અનુભવે મેળવ્યા.

ઉંડા સુધી લખીયા અમે, વાતો કરવી મોટી ગમે,

જે છી તે છી આતમરામ, ફૈગટનાં નાટક તમામ.

સ્વાધ્યાયથી સમજણુ પડી, પાટા ઉપર ગાડી ચડી,

સાધ્ય સાધન સાધના જડી, સિદ્ધિ 'અમર' નોડે કડી.

સં. ૧૯૮૪ની સાલમાં મુંબઈમાં હું એક મુસલમાન દુધનાં વેપારીની નોકરીમાં મહેતાળ તરીકે જોડયો. તેમને નાચોલેંસેના તણેલા હતા અને દુધનો ધંધી કરતા. મારે રિમની પેઢી ઉપર નાસું લખવાનું હતું. આ નોકરીમાં હું ટરીડામ થયો. છું તેમ મને લાગ્યું અને પિતાશ્રીને ટેકાર્ડપ બન્યો.

એક રાત્રે પેઢીમાં હું નાસું લખી રહ્યો હતો. લેંસેનાં વેપારીઓ. સાથે શેઠ વાતો કરી રહ્યા હતા. એક લેંસ ગુજરાતમાંથી તાળ વીંયાચેલી આવેલી, તેનું પાડુ મરી જવાથી તે વટકી ગઈ એટલે તેને કસાયને વેચવાની વાતો થતી હતી. તે મેં સાંલળા હું ચ્યમકયો. કસાયખાને વેચવાની વાતથી મારામાં ભીજરૂપે રહેલા સંસ્કારોએ મને અણુઅણુટી થઈ, હું કદ ગાડી ઉપર બેઠો છું? પાપની ધરણ ધરતી ગાડી ઉપર બેઠો છું એનું મને લાન થયું. મને આ હંયાકંડની ખબર નહોતી. આ લેંસને બચાવવા માટે મને પ્રેરણા થઈ, શેઠને વાત કરી, આ લેંસને કર્તાલખાને વેચવાને બદલે અમારા મહાજનવાળાઓને આપો તો તેનો લુલ બચી જાય. શેઠે ઝુશીથી પાંચ રૂપીયા આછા લઇને આપવા જણાયું. તેમણે જણાયું કે અમારે કાંઈ કસાયને વેચવી એવું નથી. અમારે તો દુધહેલાય ત્યાં સુખી ખોલે બાંધવાની, દુધ ઘટે એટલે તેને વેચી તેની જગ્યાએ બીજી નવી લાવવાની. એટલે આ તો અમારો દુધનો ધંધી છી. પરંતુ તેને કોઈ લેનાર હોય તો અમો વધુ ઝુશી છીએ.

આ લેંસને અલયદાન અપાવવાનું મેં બીડું અડયું, રાત્રે ઘેર ગયો. સુતા સુતા આ લેંસને કેમ બચાવવી તેનાંજ વિચારો આવવા લાગ્યા. સવારે જૈન દેરાસરોની પેઢીઓએ ગયો અને આ લેંસની હડીકત જણાવી. મને

अवेरीणज्ञरमां गोंडालाल मारवाड़ी जे आवा लुवद्यानां काची करता हुता त्यां, जवा जण्णावयुः. तेमने हुं मण्ये. तेमणे ते लेंस दा. ६०)मां लीधी अने पांजरापोणमां मुक्की आववा चीही लभी आपा, में तणेला उपरथी लेंस मंगावीने हुं पांजरापोण मुकवा गये. आ लेंसने अभयदान मणवाथी मारा आतमाए अनेरो आनंद अनुभवयो. अने मनोमन प्रतिशा लेवाई गष्ठ के आवी १०० लेंसो। मारे छाडाववी.

आ लेंसनां चैसा लेवा मने लुवद्या मंडणीमां भोक्त्यो. चैसा लक्ष्मी हुं बहार नीकणतो हुतो त्यां सामेनी चेढीमां आ संस्थानां प्रभुभ स्थापक आतमा-द्यालंकार शेठ लल्लुभार्द्ध दीपचंद अवेरी ऐठा हुता. तेओश्रीए मने खालावयो. में मारी हुकीक्ता जण्णावी अने हुं आवी पापनी गाड़ी उपर ऐठो छुं, ज्यांथी मुंगा लुवो कसायभाने वेचाय छि. हवे मारे शुं करवुं? तेतुं मार्गदर्शन माझ्युः. तंना-श्रीए मने आश्वासन आज्युः अने जण्णावयुः के तुं आ नोकरीमां नहीं हो तो पछु तेओ जे तेतुं कर्म करवानां छि ते करवानां ज है. उटातुं तारा रहेवाथी आवा लुवोने अभयदान मण्ये माटे नोकरी चालु राखवी अने ज्यारे ज्यारे आवा ढोर वेचवानां होय त्यारे लुवद्या मंडणीमां आवी जण्णावीने छाडावी लेवा. मने आश्वासन माझ्युः. संतोष थयो. आ रीते अकटभात रीते एक लेंसने अभय-दाननां निमित्तमां हुं मुंबधनी भी लुवद्या मंडणीने पगथीये पहुंचयो. में मारूं लुवन लुवद्यानां पंथे गाण-वानो निर्षुर्य मनोमन करी लीधी ते धन्य हीन ता. १३-८-१६२८नो हुतो.

અમર લુવન અહિંસા પંથે, લુવ દ્વયા રથ જોડયું રે,  
મનમાં રટણ દ્વયાતું રાખી, એ ક્ષેત્રે ચીત ચોડયું રે.-૧

રક્ષા કરવા મુંગા લુવોની, ભાવના અંતર જાળી રે,  
થંદન સમ શિતળતા વ્યાપી, સંતોષ લુવ ઉગારી રે.-૨

દ્વય વેલને દીલે ચડાવી, કર્ત્વભ્રમાં ઉતારી રે,  
માનપમાનનો ખ્યાલ તણુને, લાગણી એમાં વધારી રે.-૩

મય અઠાર વર્ષે આ તક, મળતાં પ્રેમથી જીવી રે,  
લુવ દ્વયા મુંબદ્ધ ક્ષેત્રે, એ વયમાં ખુબ ખીલી રે.-૪

શા કાજ હુણ્યાય? કેમ બચાવાય? અંતરમંથન ચાલ્યું રે,  
હરદમ લુવદ્વયાને પંથે, 'અમર' લુવન ગાળું રે.-૫

આ આનંદજનક સમાચાર મેં શેઠને આપ્યા. શેઠ પણ  
ખુશી થયા અને કસાયની ઝીંમતથી ઝા. ૫) ઓછા લઈ  
ક્ષાપવા વચ્ચન આપ્યું. મારો ઉત્સાહ વધ્યો. દર મહીને  
આઠ લેંસો નીકળે તે લુવદ્વયા મંડળી મારકૃત છિડાવી હું  
પાંજળાપોળમાં મુકવા લાગ્યો. છ માસ લગભગ બધું અરા-  
અર ચાલ્યું. પરંતુ આ તો રોજતું થયું, લુવો છિડાવવા  
ખાતે મહદ મર્યાદિત હતી. આ અરસામાં બારડોલીનો  
સત્યાગહ પૂર્ણ થયો, સમાધાન થયું. એહુતોને જરૂરિમાં  
ક્ષેંસોની બદલીમાં મુંબદ્ધથી લેંસો છિડાવીને મોકલવાતું  
નક્કી થયું અને તે કામ લુવદ્વયા મંડળીને સેંચાયું તેમીં  
ધણી ક્ષેંસો છિડાવીને ગુજરાતમાં મોકલવામાં આવી. મારી  
૧૦૦ ક્ષેંસો છિડાવવાની પ્રતિશા તો છ માસમાં પૂર્ણ થઈ  
ગઈ. આ લુવદ્વયાની પ્રવૃત્તિમાં તો મને ખાર્ફીકતા સાથે  
આર્થિક સામાલુક અને રાખ્યોથ ઉદ્ઘારનાં દર્શન કરા.

ભારતનું અણુમુલ ધન આ રીતે ગામહાઓમાંથી એંચા આવે અને લરજુવાનીમાં એક-વેતર હુધ આપી તુરત જ કસાયખાને વેચાય અને તેની કંતલ થાય, તેના પાડા-પાડી હુધ પીધા વગર કમોટે મરી જાય. અને આ રીતે ભારતનાં પણ ધનનો ભીજમાંથી નાશ થાય, એ તો સમસ્ત દેશને પ્રણાને લયંકર રીતે તુકચાન કારક આ પ્રવૃત્તીનાં દર્શન થયા. લવિષ્યમાં પ્રણાને હુધ-ધી છાસના સાંસા પડે-અને ભાવી પ્રજાનું આરોગ્ય નેખમાય, માયકંગલી પ્રણ થાય, ચેતીવાડીનાં સાધનરૂપ ખળદો ઘટે આ દીતે આ લુલદ્યાનાં ધ્યેયમાં સમસ્ત ભારતવર્ષનાં ઉદ્ઘારનાં અને આ કંતલનાં વિષમ ચક્કમાં ભારતની અધોગતિના દર્શન થયા. આ પ્રશ્ન માત્ર ધાર્મિક દૃષ્ટિની સાથે આર્થિક દૃષ્ટિએ વિચારવા જેવો વાગ્યો. પૂજ્ય મહાત્મા ગાંધીજીને આ અંગે પત્ર લખેલો તેમનાં તરફુંથી જવાબ આંદોલાયો.

વર્ધી તા. ૨૩-૮-૩૪

“તમારો લાંખો કાગળ ગાંધીજીને મળ્યો. ગાંધીજીને લુલદ્યાની વ્યાપક વ્યાખ્યા અનેકવાર આપી છે અને માત્ર પ્રાણીએને છરીથી ન હણુવાથી લુલદ્યાતું પાલન નથી થતું તે પણ જણુંયું છે.” ખ્યારેલાલ.

એટલે આ હિંસાનાં મુળમાં અનેક ખીંડ અનથો કે તે સમજાયું.

સુંખદ નગરમાં આવીયો, મળી નોકરી આ લાઈનમાં, હુઃખો સુણ્યા નન્દરે દીઠા, કકળી ઉઠ્યો મમ આતમા. સુંગા બિચારા પ્રાણીએનાં, હુઃખ ઓછાં કેમ કરું, “ભાવના જગી હ્યાની, તક મળી સાર્થક કરું.

શેડની ८ લેંસો છિડાવવામાં ખુબ કસોટી થઈ-જીવદ્યા મંડળીમાં એ ખાતે પૈસા નહોતા, શેડને લેંસો કસાયને ન વેચવા માટે નક્કી થયું હતું. શેડ લલ્લુલાઈની આશાનુસાર હું ધણું શ્રીમંતોને ત્યાં જઈ આવ્યો. પરંતુ પૈસા મખ્યા નહીં. આમ કરતા કરતા ૨૦ દિવસ વ્યતીત થઈ ગયા. ઐલુ લેંસો નીકળવાની તૈયારી હતી. હું મુંજવણુમાં મુકાયો. આ લેંસોને એ ત્રણું વળત હાથ ફેરવી આવ્યો હતો, આ લેંસો કસાયને વેચાય તો મારું દીલ કપાય જાય તેમ થયું. શેડની પાસે એક દીવસની મુદ્દત માગી. શેડ લલ્લુલાઈને મળ્યો તેઓએ લાચારી ખતાવી મારી આંખમાં આંસુ આવી ગયા. હું પેઢી ઉપર આવ્યો ૪-૫ કાગળો લઈ દર્દભરી અપીલ કર્યું. લખતા લખતા પણ આંસુ કાગળ ઉપર પડી ગયા. તેમાં જણાયું કે-૮ લેંસો છિડાવવાનાં ડા. ૫૦૦) જીવદ્યા મંડળીમાં કાલે ૧૨ વાગ્યા સુધીમાં ભરવામાં આવશે તો જીવોને અભયદાન મળશે નહીંતર કર્તાલખાને વેચાશે. આ અપીલો દેરાસરોએ ચોડી, મહાજનમાં ચોડી, મને આખી રાત ઉંઘ ન આવી. સવારે ઠેઠેલો ઉઠ્યો પૂજસેવા કરી ८ વાગે જીવદ્યા મંડળીમાં ગયો. ત્યાં એ શ્રીમાનો લલ્લુલાઈ શેડ પાસે એડા હતા. મને લેઇને મોાલ્યા આવ બચ્યા તારું કામ થઈ ગયું છી, ઇપીયા આવી ગયા છે અને લેંસો લઈને પાંજરાપોળમાં મોકલાવી હેવાનો છી. હું તો હર્ષભેર દોડ્યો શેડની પેઢી ઉપર, ત્યાં શેડની ગાડી રસ્તામાં મળી, શેડને વાત કરી, ત્યાં શેડ જણાયું કે લેંસોનો સોઢો ગઈ કાલે કસાયોને થઈ ગયો. હું તો ઉથ બની ગયો, અને જણાયું કે મેં તમોને ૧૨ વાગ્યાનો ટાઇમ આપ્યો છી, તમારાથી કસાયને વેચી જ શકાય નહીં. શેડ વિચારમાં પડી ગયા, રહ્યો, લેંસોને લઈ ગયા નહોતા, તેમણે મને એ આના

આપ્યા અને તથેલે તુરત જઈ લેંસો છાડી ન આપવા. કૌચાને કહેવરાંયું: હું તો સીધો તથેલે ગયો. લેંસો કસાચીને ખોલી ન આપવા જણાવતા લૈયા પણ ખુશી થયા. લેંસો ઉપર હાથ ફેરવી આવ્યો. આ લેંસોને પાંજરાપોળમાં સુકાવી મહાન કસેટીમાંથી પસાર થતાં માર્દ આત્મભળ સતેજ થયું. આ લુલાદ્યાનું સર્કિયકાર્ય વાપકપણે કરવાની તમજા જાગી. મારી અપીલથી લગભગ ૧૫૦૦) લુલાદ્યા મંડળીમાં ભરાયા હતા અને બીજુ લેંસો પણ છાડાવવામાં આવી હતી.

લીલાચારા ગીરનાં, અને નિર્મણ નહીનાં નીર,  
રૂષપુષ્ટ તેથી ઘની, દેતી હાંડો ક્ષીર.

વેચાણી સુંખદ વિષે, આપ્યા વણુસો દામ,  
સાગરમાં વહાણે ચડી, પહેંચી સુંખુદ ધામ,

પોણો મણુ દુખ માડું, દેતી દીનને રાત,  
ગીરની રાણી લાગતી સુંદર મારી જત.

શેડ પેઢીમાં ખેડા હતા, રાત્રે હું નાસુ લખી રહ્યો  
હતો. શેડ જણાંયું કે એક લેંસ ઝા. ૩૧) માં કસાયને  
વેચી છી. તેનાં પૈસા આવ્યા નથી. મારે શેડની સાથે કરાર  
હતો કે લેંસો ગાયો વેચવા હોય તો મને જણાવવું. મેં  
જણાંયું કે એવી કેવી લેંસ કે માત્ર ૩૬) માં વેચી. અને હું  
દીનાર હતો છતાં શું કામ કસાયને વેચી? શેડ જણાંયું  
કે પણવાવાળાએ જોઈને કીધું કે આ લેંસ ધરવી છી એટલે  
દીમી નહીં એટલે મને ખીજ ચઢી કે તમારે લુલાનું કામ  
કું કે ધરવી જુવાનનું કામ છી? અને તેથી જોઈને કસાયની  
સાથી કરી દીખ્યા. પણ તેમણે જણાંયું હેઠળ આ લેંસ હું

ગોરમાંથી ૧૨ વરસ પહેલા રૂ. ૩૦૦) માં લાવેલો તેણું દીવસતું પોણોમણું હુંઘ હતું. આ લેંસ વેચતા મને પણું હુંઘ થયું. મેં જણાઓયું કે આ લેંસ લઈ ગયા નથી, તો મને આપી ધો હું પાંજરાપોળમાં મુકાવી દઈએ ને તમોને પૈસા અપાવી દઈશ. શેડ ખુશી થયા અને કસાયનો સોઢો હોએ કર્યો. શેડ લલ્લુભાઈને હુકીકત જણાવી. તેમણે લેંસ લઈ આવવા જણાઓયું. શેડ લેંસને નવરાવી તેલ ચોળીને લૈયા સાથે મોકલી. ઘરડી છતાં જાઝરાવાહી સીંગડા, હાથી જેવું કહ, પગ સુધીનું લાંબુ પુંછડું, પાંદડી ઘાટનું તેણું માથું. આ લેંસને શેડ લલ્લુભાઈએ જોઈ. આવા પરોપકારી જાનવરો આખરે સ્વાર્ય સરતા વૈધ વેરી જેમ કસાયને વેચે છે તેથી હુંઘ થયું અને આ લેંસનો હોટો પડાવી પછી પાંજરાપોળમાં મુકવા જણાઓયું તેનો હોટો પડાયો, હું સાથે હતો. આ હોટો જીવદ્યા મંડળીનાં રજત મહેતસવ અંકમાં પ્રસિદ્ધ થયો. જને ૧૬૭૪માં જીવદ્યા પરિષદ્ધતું હતું અધિવેશન ભરાયું હતું તેમાં મેં ભાગ લીધ્યા હતો. આ લેંસનું કરણું વૃતાંત હેનીક પત્રોમાં પ્રસિદ્ધ થયું અને હિંદતું હીર કદ રીતે ભારતવર્ષમાં હણ્યાઈ રહ્યું છે તે દર્શાયું. મેં એક કાબ્ય શતક હરિગીત છંદમાં “હિંદતું હણ્યાતું હીર વાને મુંખદના હુધાળા ઢારોની કરણું કથની” નામતું ૧૩૦ કદીતું લખ્યું અને તેમાં તે હોટો મુકીને જીવદ્યા મંડળીએ તેનું પ્રચાર માટે પ્રકાશન ૧૬૭૪માં કર્યો હતું.

જીવદ્યા મંડળી તરફથી જેની ત્રણ આવૃતી પ્રસિદ્ધ થઈ હતી. જીવદ્યા માસિક અને ગોઆસ ગોશુલ હાનમંદળ તથા ગોઆસ કિસા તરફથી, શ્રી જયંતિલાલ નારકલાલ માન્કરના લંત્રીપણા નીચે “જીવદ્યા” અને “ગોઆસ”

માર્ગનક પ્રાસંગ થતા હતા. મારા આ વિષયનાં અનુભવનાં હેઠો! કાંચો તેમાં સને ૧૬૩૦-૩૧થી શરૂ થયા હતા જે અધારી લુલદ્યામાં ચાહું છે.

ગજતથ્યા અવતારમાં, સસલુ ભયાંથ્યું એક;  
મેધકુમાર રાજ થયા, ધન્ય અહિંસા એક.

શેઠને ત્યાં બાળકોને રમવા માટે એક સસલું લાવવામાં આંથ્યું હતું, તે મોદું થતાં કરડવા લાંથ્યું. એટલે તેને મારીને ખાઈ જવાની વિચારણા કરતા હતા. મોટા શેઠ દ્વારા દીલનાં હતા. મને જણ્ણાંથ્યું કે મેતાળ આ સસલાને બેળીમાં નાખી પાંજરાપોળમાં લઈ જાઓ. નહિતર આ બધા મારીને ખાઈ જશે હું સસલાને લઈ પાંજરાપોળ મુકુવા ગયો. તેનાં નકરાનાં પૈસા ભરી પાંજરાપોળમાં મુકી દીધું, ને મેધકુમારનો હાથીનો ભવ યાદ આવ્યો.

અન્ય દાનોનાં ઝોણો, કાળો કરી ક્ષય થાય છે,  
પુન્ય અલયદાનનું, અક્ષય સદાયે હોય છે.

શેઠનાં તખેલામાં-જે લેંસોનાં નાના કુમળા પાડા પાડી હોય તે જ્યાં સુધી બચ્ચા વગર હોહવા ન હે ત્યાં સુધી ખવરાવે અને લુલવવા પ્રયત્ન કરે, કારણુકે શેર દુધ બચ્ચું પીધ જય તે વેપારીને પોસાય નહીં. જેનો કુદરતી હક્ક છે. તેની ઉપર પણ સ્વાર્થને કેટલો જુલમ છે. એટલે જ સુંભરનાં દુધને બોણી ગણુવામાં આવતું. આ બચ્ચા દુધ વગર બેચાર દીવસ રીબાઈ રીબાઈને ભરી જય, કાગડાઓ આંખો ડોલી જય. આવું કમકમાટીભયું મૃત્યું-ભાવી લેંસોનું થતું હતું. શેઠને જણ્ણાંથ્યું કે તમારે જ્યારે પાડુને

ધરરાવવાતું અંધ થાય એટલે તમારે પાંજરાપોળમાં તમારા ગાડામાં મોકલી આપવા. મેં પાંજરાપોળમાંથી ફરમીટ હાકુ ચાજ્જથી લાવી આપેલી. મરી જતાં પાડાને ઉપાડવાને ઝા. ૧) ક્રી હતો. પાંજરાપોળમાં આઠઆનામાં દાખલ કરવાતું નક્કી કર્યું. આ રીતે વરસો સુધી નાના બગ્યાએ. પાંજરાપોળમાં મુક્યા હતા.

હિંસાતું મનમાંહી રટણ સઢા, ચંદ્રસમી શીતળ હૃદયા, માર શખ્ફો વહો જીવો શા મારે? હુરદમ હીલે જીવદયા.

એક દીવસ વાંદરાદું કર્તાલખાતું જોવા ગયા. આ ભારતતું પશુધન કઈ રીતે કર્તાલ થાય છે, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવા અને હૃદયમાં તેનો પ્રત્યાધાત પાડવા આ સાહુસ જેડયું. ગાયોની, બકરાની કર્તાલ નજરે જોઇ હૃદયને ખુબજ મજબુત બનાવી આપો. ચિતાર લીધી. તેનાં હાડકા, ચામડા, લોહી, ખરી, સંગડા વીગેરનો શું ઉપયોગ થાય છે, આ બધા વ્યાપારમાં આપણા સમાજનો પણ કેટલો શયંકર હીસ્સે. છે. કર્તાલમાં માંસાહારીએ. સાથે આપણી કેટલી બધી લાગીદારી છે. આપણે તે વસ્તુઓનો વ્યાપાર કરી તેનો ઉપયોગ કરી કેટલું ઉતોજન આપીએ છીએ. આ કર્તાલ કેમ અટકેં આપણી કરજ શું? સરકારની કરજ. શું? આ પશુધનની હિંસાથી દેશને સમાજને કેટલું નુકશાન ની. સચ્ચાટ રીતે બેખ લખેલ. સામાયેકોમાં તે હૃદયદ્રાવક ચિત્ર વાંચી અનેક રહી પડેલ. હિંદતું હણાતું હીરતું કાન્ય વાંચી એક ગુર્જર કવીએ લખેલું કે-

“હિંદતું હણાતું હીર વાંચી, ઉમીં વધશે અંતરમાં.”

જીવદયાની મદદ ઉપર આ પ્રશ્નનો ઉકેલ અશક્ય હતો.

તેને માટે વ્યવહારું ઉપાય શોધવાની જરૂર હતી. આ ગાયો કેસેંસા હુધ ઉપરથી ઉતરી ગયા પછી, કર્તાલખાને વેચવાને બદલે ગુજરાતના જંગલોમાં પશુ પાળકોને પાળવા માટે આપવામાં આવે તો પશુઓના વિનાશ અટકે અને દેશ પ્રણાને લાલ થાય. એ માટે ગવડીઓમાં પ્રચાર કર્યો તેઓએ રેલવેનું જો કંસેશન મળે તો પોષાળ થાથ એટલે આ ભાખત શ્રી માન્કર લાઈને જણાવી. બી. બી. સી. આઈ રેલવે ઉપર અરજીનાં ડ્રાઇટ એ ટાઇપ કરાવ્યા. અને તેમાં મેં ગવડીઓની તખેલે તખેલે ફરી શેડ સાથે જઈ સહીઓ લીધી. રેલવેએ ૪ માસ માટે તુરમાં રૂપ/ટકા નો લાલ આપ્યો. મેં આ ભાખત વર્તમાનપત્રો મુંણઈ સમાચાર, સાંજવર્તમાન, લુવદ્યામાં કર્તાલખાને વેચાતી ગાયો કેસેંસેને ગુજરાતમાં પાળવા માટે અને તેમાં થતા લાલનો આંકડા સહીત ચોજનાઓનાં આઠીંકલો લખ્યા. મારા શેડ તરફથી પાલઘર મોકલવાની શરૂઆત કરાવી પાછળથી આ ચોજનાને ખૂબજ વેગ ભય્યો અને લુવદ્યા મંડળીનાં રિપોર્ટ મુજબ એ વરસમાં ૧૪૦૦૦ કોંસેસ ગાયો ગુજરાતમાં પાળવા માટે ગઈ. અને આ વ્યવહાર ચોજનાથી લુવદ્યાનું મહાન કાર્ય વગર પૈસે થયું અને તેમાં સફળતા મળી.

આ રીતે મારી પ્રવૃત્તિ ધાર્મિક, આર્થિક, રાષ્ટ્રીય દૃષ્ટિએ વ્યાપક બની ગઈ. મારા યુવાનીનાં લુવનમાં આ રાષ્ટ્રધનનાં બચાવ માટે લુવદ્યા માટે સુવર્ણ તક સાંપડી તેનો મેં સહઉપયોગ કર્યો મારા લંઘ સં. ૧૯૮૬નાં કારતંક વદી ૧૨ ગુરૂવારે મહુવાબંદર અ. સૌ. સૌલાય સાથે થયા હતા. પરંતુ મારું લુવન લુવદ્યાનાં કાર્ય માં એસ્ટિપ્રોટ હતું. આ ચોજનાને વહુ વિકસન કરવા માટે પંજરાપેણોનો

સહકાર મળ્યો. અમદાવાદ પાંજરાપોળ, સોલાપુર પાંજરા-પોળ, રાવળગામ કેટલક્ષાર્મ, પુના પાંજરાપોળ વી. ને અત્રેથી હું ઉપરથી ઉતરી ગયેલી ગારો લેંસો લાં લઈ જઈ તે દ્વારા તેરી ઝામો શડ કરી, લેંસો ગારો કટલથી બચે અને જનતાને હું મળે એવી વ્યવહાર ચોજના લુલદ્યામંડળી દ્વારા થઈ. અડધા પૈસા પાંજરાપોળવાળાઓ આપે અને અડધા પૈસા લુલદ્યા મંડળી આપે. રેલવેમાં લઈ જવાનું પાંજરાપોળને હિસાબે નક્કી થયું. આ દરેકને તણેલે તણેલે ઇરીને જાતિવંત લેંસો અપાવવાનું કાર્ય લુલદ્યા મંડળી તરફથી મેં સ્વિકાર્યું. આ રીતે પણ સેંકડો લેંસો પાંજરાપોળમાં ગઈ અને તેરી ઝામો શડ થયા. પર્યુખણુમાં સંવત્સરીને દીવસે તો સવારે ૭ વાગ્યેથી લુલો છાડાવવા માટે નીકળી જઉં અને સાંજે સોએક લુલોને લુલિતદાન આપી તે બધા પાયધુની ત્રાંબા-કાંટાના બગ્ગીચા પાસે પ્રદર્થન કરું. તે દીવસે ઉપવાસ પૂર્વે આ પ્રવૃત્તિ ચાલતી. મારી ઇમ પણ ત્યાંજ જ્વેર ગુમાનના માળામાં જ હતી. ૧૨ વરસમાં મારે સંવત્સરી પ્રતિક્રમણું તો થયું જ નથી, પરંતુ લુલદ્યા અભયદાનનું કાર્ય કરી સંવત્સરીએ ઉજવા છે.

એક વખત એ રીતે પર્યુખણુમાં મારે ઉપવાસ હતો. હું શેડને તણેલે કામ હોવાથી ગયેલ. અમારે સંવત્સરીનાં દીવસે લુલો છાડાવવા હતા. પરંતુ તેઓએ ૭ લેંસો કસા-ઇને મારી જણ બહાર વેચેલી તેને વાંદરા કટલખાને લઈ જવા માટે કસાચો હોરડા લઈ આવેલા. મેં શેડને પુછ્યું કે શા માટે આવ્યા છે? શેડે હકીકત જણાવી એટલે ચેંકણું કે આ લેંસો કટલખાને હવે નહીં જઈ શકે અમેં લઈ લઈશું. શેડે કખાયોને લેંસોમાં હું છે એવું ખાતું કાગી.

પાછા કાઢ્યા. હું સાંતાકુજ જઈ શ્રી માન્કરલાઈને મળ્યો.  
અને મારા સાહસની હુકીકત જણાવી તે વખતે શેઠ લલ્લુ-  
ભાઈને વલસાડમાં અહૃાઈ હતી. આ લેંસો છિડાવીને  
પાંજરાપોળ મોાંલાવી આવા આવા અનેક પ્રસંગો અલયદાનનાં  
ઘન્યા છે. અને તે અંગે આત્મવિદ્યાસ પૂર્વક પ્રવૃત્તિ કરી  
હજારો લુવોનાં અલયદાનમાં નિમિત્ત થયો છું. શેઠ લલ્લુ-  
ભાઈ મારા લુવદ્યા ક્ષેત્રમાં પિતા હતા. અને શ્રી માન્કરલાઈ  
મારા ગુરુ છે. તેઓ શ્રીની પ્રથમ પ્રેરણુથી મારું લુવન  
લુવદ્યાના પંથે પ્રગતી કરી શક્યું.

હિંમત ઘણી આપી મને, શ્રીમાન લલ્લુભાઈએ;  
ને પ્રેરણું પાઈ મને, શ્રીયુત માન્કરલાઈએ.  
ઉપકાર માતું સર્વનો, બુદું નહિં હું લુવદ્યા;  
અંડો ‘અમર’ અહિંસાતણો જયોતિ જગાવું લુવદ્યા.

શ્રી લુવદ્યા મંડળીના પ્રમુખ-દ્યાલંકાર શેઠશ્રી લલ્લુ-  
ભાઈ દીપચંદ જવેરીએ ‘હિંદના હણ્ણાતા હીર’ની બીજી  
આવૃત્તિની પ્રસ્તાવનમાં લખ્યું છે —

“ ભાઈ અમરચંદ માવજુ થાહને નહાની વયથી જ  
લુવદ્યાને લગતી સેવાએ કરવાનું વ્યસન છે. તેઓ વખતો  
વખત સુંભઈ લુવદ્યા મંડળીને આશ્રયે ચાલતા અલયદાનના  
પ્રયાસોને પણ મદદ કરે છે. આવા ચુવડો અહિંસાના કાર્યમાં  
સક્રિય રસ દે એ આશાજનક છે. ભાઈ અમરચંદની લદી  
લાગણી અને લદી પ્રવૃત્તિ માટે તેમને હું અલિનંદન આપું  
છું એને ભવિષ્યમાં તેઓ અલયદાનનાં મહાન કાર્ય કરવા  
સમર્થ બનું એમ ધર્યું છું.”

શ્રી લુલદ્યા મંડળીના મંત્રી રાવખાહાદુર શ્રી જ્યંતી-  
લાલભાઈ એન. માન્કરે ગોઅસ માસિકમાં ગોઅસની પેટીઓ  
મુકવાની સેવા પ્રસંગે લખ્યું છે કે—

“લુલદ્યા અને ગૌરેસેવાના જાણીતા હિમાયતી શ્રી અમર-  
ચંદ માવલુ શાહ આ કાર્ય માટે તન-મન અને ધનથી હું મેશા  
સેવા કરે છે અને પરિણામે લુલોના અલયદાનના પુન્યના  
તેઓ ભાગીદાર બને છે. કષાયને વસુકી ગયેલી ગાયો લેંસો ન  
આપવા માટે, ગવલીઓને સમજવવા માટે, વસુકી ગયેલી ગાયો  
લેંસો. ગુજરાતમાં પાળવા મોકલવા તથેલાવાળાઓને સમ-  
જવવા માટે, વિગેરે સેવાના કાર્યો માટે તેમના પ્રયાસો  
પ્રશંસનીય છે. તેઓ મુંબઈ લુલદ્યા મંડળી, શ્રી ગોઅસ  
લિક્ષા સંસ્થા, શ્રી ગોઅસ ગોલુલદ્યાન મંડળ વિગેરે સંસ્થાની  
સાથે રહી માનદું સેવા કરેંછે. તેમને અમારા અલિનંદન છે.

એક વખત બકરીઈદ્દ ઉપર ગોઅસ તરફથી ગાયો  
છાડાવવા હું ગોળવાળા શેડ સાથે ગયેલો. અમારા શેડને  
ત્યાં એ સારી ગીરની ગાયો જોઈ અને તે વેચવાની હતી.  
શેડ તેના (૬૦) ઝા. માઘ્યા. ગોળવાળા શેડે ઝા. (૬૦) માં  
માંગણી કરી એટલે સોઢો થયો નહીં શેડ ગયા પછી ચેં  
ગાયો બન્ને લોયા સાથે ગુલાલવાડીમાં સત્યનારાયણ મંદીર  
મોકલી આપી અને શેડને જણ્ણાંયું કે ઝા. (૩૦) મારા ખાતે  
માંડલે. શેડ ખીજણું પરંતુ ગાયો બચી ગઈ અને મારી  
પાસેથા પૈસા લીધા નહીં. એક વખત એક ગાય તથા વાછડું  
ઝા. (૩૫) માં છાડાવીને શાંતાકુઝ મોકલવા જણ્ણાંયું. લોયાને  
ઠેકાણું ન મળ્યું ગાય પાછી આવી શેડે તે કસાવને વેચી  
દીધી. મેં એત્રણ દીવસે પુછ્યું કે ગાયની પહોંચ લાવો  
એટલે પૈસા લાવી દઉં. શેડ કહે કે એ ગાય તો ખાંઝી

આવી અને મેં વાંદરા વેંચી નાખી. હું તો ધમધમી ગયો. માર્ઝ છિડાવેલી ગાય કસાયને વેચાય જ કેમ? મેં જણુંયું કે કાંતો માર્ઝં તમે રાણુનામું લ્યો અગાર એ ગાય મને પાછી લાવી આપો. સારા નસીબે શેઠને તરકીબ સુણ્ણ. ગાય કસાય હોરી ગયો હતો પણ તેનું વાછડું ભૂલી ગયો હતો. તે લેવા આવ્યો એટલે વાંધી પાડ્યો કે વાછડાનો સોહો નથી અને ન પોખાય તો ગાય પાછી લાવ. છિવટે આઠમે દીવસે વાંદરાનાં કતલખાનેથી ગાય પાછી આવી.

આવા આવા અનેક પ્રસંગો સંવત ૧૯૮૪ થી સંવત ૧૯૯૮ સુધી ૧૪ વરસમાં લુવદ્યાનાં કાર્ય પ્રસંગે બન્યા છી. અનેક વખત એ માટે રજ્યો છું, અનેક વખત સાહસો જેક્ષા છી, સેંકડો લેખો ને કાબ્યો લખ્યા છી. સંવત ૧૯૯૯માં મેં નોકરી છાડી દીધી. અને હું લુવદ્યા મંડળીમાં મારી લુવદ્યાની ગાડી વ્યવહાર, વ્યાપારનાં ખાડામાં ન ઝુંચી જાય તે માટે સ્વ. શેઠ લલ્લુલાઈની તથા શ્રી માન્કરલાઈની પ્રેરણાથી લુવદ્યા માસિકમાં પણ્ડાસીટી મેનેજર તરીકે જોડાયો. પાપની ગાઢી ઉપરથી કાદવમાં કમળ જેમ હું લુવદ્યાની ગાઢી ઉપર આવ્યો. અધ્યાત્મિકતાનું પ્રથમ સોાપાન અહિસા-લુવદ્યાનું સંક્રિય કાર્ય કર્યો બાદ મને ચોગ આધ્યાત્મમાં આગળ વધવા તીવ્ર જિજાસા થઈ એક આદર્શ સત્પુરુષનો ચોગ મળી જાય તો તે આદર્શ મુજબ હું માર્ઝં લુવન ચોગ પંથે વહાનું તેવી ભાવના થઈ. અને અકસ્માત મને આદર્શનાં અરીસા જેવું શ્રીમદ્ રાજયંત્રનું લુવન ચરિત્ર સાંપડ્યું મને ઝુખજ પ્રેરણા મળી એ અક્ષર-હેઠી સત્સમાગમનાં લીધી મારામાં આધ્યાત્મિકતાનું જરણું આપ્યું, તેમાં હું ઝુખજ ઓતપ્રોત થયો. ગુદ્યપદમાં મારા

લખાણું શરૂ થયા સાંપ્રત સપાઈ ઉપર-તરતું જીવન  
-જીવદ્યાનાં વારી સીંચનથી નવ પલ્લવીત થયેલું દીક-  
અંતમુર્ખ-આત્મ સાધના તરફ વળ્યું આ અકદમાત પરિ-  
વર્તાન સત્પુરુષનાં ચોંગે પ્રાપ્ત થયું. મેં તેમને મારા આદર્શે  
રૂપે હૃદયમાં સ્થાપ્યા અને તેમાંથી “અમરઆત્મ મંથન”નો  
જન્મ થયો.



જાણુતા ન આંધું લાન, ગણુતા ન આંધું જાન;  
બિક્ષુક શું હે દાન ? પણ કુદરત થછ મહેરભાન.  
કુદરતી ધારા વહી રહી, કયાંથી પડતી ધાર;  
કલાંધું નહીં કલપાય અહીં, ચીંતવન મન આધાર.  
અમર આત્મમંથન મહીં, જે જે લખું હેખાય;  
કુમ તેનો કાંઈ નથી, જ્યારે ત્યારે લખાય.  
ત્રણ દશકાની વય પણી, સન ચાલીસ શરૂ થાય;  
અંતરમંથન ઉદલોંધું, ગધ-પધ રૂપે ત્યાંય.  
સમુદ્રનાં મંથન થકી, પામ્યા હેવો સત્ત્વ;  
અમર આત્મ મંથન લખે, અહુવા જાનતું તત્ત્વ.

આ રીતે જીવદ્યા સાથે-આધ્યાત્મ તત્ત્વને ચોંગ પ્રાપ્ત  
થયો, દ્વારા-આનંદ પ્રેમ શાંતિ પુરુષાર્થની પ્રેરણું મળી.

૨૪૪ યશ રળીયામણું, અંદની જયેતિ સમાન;  
રદ્ધા વધુ જે જીવનમાં, દાસ ‘અમર’ પિણાન.

संवत् १९६८नी सालमां-गुरुरोपनी यादवा स्थળीनी आग हिंदनां कीनारे पहेंची, मुंबईमांथी हीजरत शड थઈ. अमो इगण्डु वही १नां हुं तथा मारा पत्नि मुंबई छाडी पच्छिगाम आयथा मारा लघुभंधु दलीचं हे खीलपुर कण्ठीटकमां सायकलनी हुकान करी. अमारो मुंबईनो पूर पिताश्रीओ रचेलो गढ वीआईगयो. हुं लावनगरमां संवत् १९६८ अषाढ शुह उनां रोज मारा स्नेही भुरण्यी श्री गुलाबचं ह लव्लुलाईनां अंगुडी निर्देषथी अने श्रीमान खांतिलाल अमरचं ह वोरानी ग्रेरणाथी, श्री लावनगर पांजरापोणमां मारा ज्ञवह्यानां ध्येयने साचववा भेनेजर तरीके निमायो अने नवुं सोपान शड थयुं “मुंगी हुनीया” हुं सुकान संलाज्युं. मुंबईना अनुलवोने ग्रेकटीकल करवानी तक सांपडी. तन-मनथी पांजरापोणने आदश्य अनाववा समठीयाणा शाखाने आभाद अनाववा योजनाच्यो करी, महानी योजनाच्यो करी, साल-मुखारक-मकरसंकाती-पशुंषु-लीलोचारो-तिथीइंड - मकान इंड पेट्रन वी. थी आवकनी नीक शड करी. पांजरापोणमां पालन विभाग-सारवार विभाग-हुगधालय विभाग-उछिर विभाग-ऐतीवाई विभाग-वीरोदे शड कराया, तेनो रिपोर्ट १० वरसनो सुंहर प्रसिद्ध कर्यो, समाजमां जागती आवी. व्यवस्थीत वहीवट चालु थयो. लावनगरमां वडवा वाववाणी शेरीमां जाडाथी मकान लध मारा पत्निने तेडावी. मारा ज्ञवननी नवी यात्रा शड करी.

लावनगर गोलंगंवर्धन मंडणमां मारी मानद मंत्री तरीके नीमणुंक थयेली, तेमां शहेरनां अथगण्ड्य नागरीको मुख्य हुता. ने ना. महाराजा साहेबनां सानिध्यमां पशु प्रद. शेनो गंगाजगिया तणावमां जरायेल अने इनामो ०५ चायेल. आ संस्थामां ऐ वरस सेवा आपी हुती.

ભાવનગરમાં જૈન ધર્મપ્રસારક સભા, આત્માનંદ સભા, પણોવિજય જૈન અંથમાળા, જૈન પત્ર વી. સંસ્થાઓને સંપર્ક થયો. મારા ગદ્ય-પદ્ય લખાણું ને પ્રસિદ્ધી મળવાની તક મળી. મહુગત ધર્માત્મા શ્રી કુંવરલુલાંધ આણું દળુંને સત સમાગમ પાઠ્ત થયો. મારી પ્રત્યે અન્યન્ય લાગણી ધરાવતા શ્રીમાન ગીઠ શ્રી લોણીલાલલાંધ મગનલાલની રહાયથી અને મારા મુરણી શ્રી આંતિલાલલાંધ અમરચંદ વોરાની પ્રેરણુથી શ્રી આનંદ પ્રોન્ટીંગ પ્રેસ દ્વારા મારા સ્નેહી લાંધશ્રી ગુલાબચંદ ડેવચંદ ત્થા શ્રી હરીલાલ ડેવચંદનાં લાગણી લર્યો સહૃકારથી જીવત ૨૦૦૨માં “અમર આત્મમંથન” અંથ ગદ્ય-પદ્ય કુપે પ્રસિદ્ધ થયો. તેની પ્રસ્તાવના મારા મુરણી શ્રીમાન ઇતેહચંદ જવેરલાંધ શાહે લખી અંથતું મહત્વ પ્રસિદ્ધ કર્યું હતું. સંવત ૨૦૦૪માં “જ્ઞાન ગીતા” નામની બુક પદ્યમાં મારી ધ. ૨૦૦૩ની બીજાપુર(કણૌટક)માં મારા પૂ. પિતાશ્રીનાં અંતિમ દર્શનની યાત્રા સમયે સહૃદ્યી શ્રી સોમચંદલાંધ દલીચંદ ધાહની રહાયથી પ્રસિદ્ધ થઈ હતી. આ રીતે મને જીવદ્યા કાથે મારા અધ્યાત્મ ચોગની ભાવનાને પણ પોષણ મળ્યું.

સંવત ૨૦૦૫માં સૌરાષ્ટ્રમાં ભયંકર હુંકાળ જણો. પાંજરાપોળનાં ઢારે ગીરમાં મોકલવા પડ્યા. એ આઘાત પ્રત્યાઘાતની અસર શરીર ઉપર થઈ. હું ગીરમાં ગયો. ત્યાંની ગરમી અને અંતરની વેદનાથી સખ્તાબિમાર પડ્યો. પરછી-ગામ વૈધશાજ નાગર્વાસભાંડ પ્રમાણંકર ભટ્ટની સારવારથી આરોગ્ય પ્રાપ્ત કર્યું. સંવત ૨૦૦૬ની સાલમાં હું પાંજરા-પોળમાંથી છુટો થયો અને મહુવા મારા પતિન સાથે હુંબા-ક્રદ્વા જયો. ત્યાંથી આવી વિદ્યાવિજય પ્રી-ટીંગ પ્રેસમાં મારા મુરણી સ્નેહીશ્રી શાંતીલાલલાંધ બુર્ઝેતમદાસ ગીગા-

ભાઈની લાગણીથી મેનેજર તરીકે નોડાયો, તે દરમયાન “સાધના” અંગે ખુખ જ પ્રેરણાચ્ચો પ્રાપ્ત થઈ. સંવત ૨૦૧૦ની સાલમાં હું તેમાંથી છુટો થયો અને મારા મુરળણી શ્રીમાન શેઠશ્રી લોઙીલાલભાઈ સાહેબની લાવનાથી અને તેચોશ્રીની આજાર્થી હું “તાલધ્વજ નૈન શ્રી. તીર્થકમ્પિતી”માં મુનીમ તરીકે સંવત ૨૦૧૦નાં પોષ શુદ્ધી ૧૩ના તળાજ મારા પતિન સાથે આવ્યો અને તાલધ્વજ તીર્થની સેવાનો ક્રીંજે તખકડો શરૂ થયો. શુદ્ધયાને આંગણોથી પાંજરાપોળનાં બારણોથી તાલધ્વજ તીર્થનાં શીખરે અમરશુદ્ધન સ્થીર થયું -તીર્થભક્તિ સાથે તીર્થઉદ્ઘારનાં કાર્યમાં સંકિયપણે સેવા શરૂ કરી. સાચાદેવની છતછાંયા પ્રાપ્ત થઈ. આજ વરસના વૈશાખ શુદ્ધી પનાં આવન શુનાલય મહાવીર પ્રાસાદની ભાવ્ય ગ્રતિષ્ઠા થઈ.

ધર્મની દુકાનમાં એઠા અમે, લઈએ દાનને દઈએ પુન્ય;  
નહોં જાનેરો લાલ અનેરો, કરીએ કમાઈને તુટઃમાં શુન્ય.

મારા આરોગ્ય માટે ચોગ માટે પણ આ ક્ષેત્ર મને  
અનુકૂળ લાયું.

તાલધ્વજ ગિરીરાજશુ, લાચા સુમાતે લાણુંદ;  
ભાવ ધરીને લેટતાં, થાય ‘અમર’ આનંદ.

તાલધ્વજ તીર્થનો સર્વાંગી વિકાસ કરવા માટે “ઇંટ  
થર્સ” શરૂ કર્યો તેમાં સારી સંક્રાંતા મળી. હુલામાં બંધાઈ  
રહેલા આયંધીલભુવન ઉપાશ્રય-જાનમંદીરનાં તા. ૩-૫-૬ઉના  
દીને ખાતમુહૂર્ત પ્રસંગે પૂજય મુરળણી શ્રીમાન શેઠશ્રી  
લોઙીલાલભાઈ સાહેબે વ્યક્તાંય કરતાં જણાંયું હતું કે:-

“તળાજ તીર્થ અત્યંત નૈસર્ગિક વાતાવરણમાં આવેલું  
છે. આ તીર્થની યાત્રા કરતા મન પ્રકુદ્ધલીત બને છે અને

ચિત્તને શાંતિ મળે છી. આ તીર્થના વિકાસનો ઈતિહાસ ઘણ્ણો તાનો છી. છિલ્લા એક દ્વારા આ તીર્થ વિકાસ પામતુ ગયું છી. નળ-બાઈટ નૂતન લોજનગૃહ-ગિરીરાજ ઉપર ચડવાનાં પગથીયા અને આધુનીક સગવડોએ આ તીર્થને તીર્થધામની આથ્રાસાથ હુવાખાવાનાં સ્થળ તરીકે પણ પ્રસિદ્ધી અપાવી છી અને હુવે એ સગવડોમાં આયંભીલભુવન ઉપાશ્રય હોલ અને જાન મંદ્દીરનો વધારો થશે. આ વિકાસનો યથ તીર્થ કમિટીને તો છી જ પણ એમ કહું તો હું પણ તીર્થ કમિટીનો પ્રમુખ હોઈ મારા જ વખાણું મારા મોઢે કર્યા ગણ્ણાય, એમ છતાં આ પ્રસંગે ભાઈ અમરચંદ વિષે એ શરૂદો કહું તો અચોગ્ય નહીં ગણ્ણાય.

ભાઈ અમરચંદ ખુખ જમંગ અને ધગશથી તીર્થ વિકાસનાં કાચો એક સાચા સેવક તરીકે કરે છી એ બદલ હું તીર્થ-કમિટી બતી આનંદ વ્યક્ત કરું છું ”

તીર્થકમિટીની મારા પ્રત્યે ખુખ જ ઉંડી લાગણી છી. લાગ્યવંત કમિટી અને મહાયુન્યવંત તેનાં પ્રમુખ શૈક્ષણી શોભાલાલભાઈ સાહેબનો હું આલારી છું. હું તો એક અહનો સેવક છું. મેં તો એક જ સિદ્ધાંત રાજ્યો છી કે

“ કુર્તાંય પાલન એજ ‘ અમર ’નો ધર્મગણ્ણાયો ॥ ”

આ કાર્યમાં મારા સાથીદારો ભાઈ જમનાદાસ નાનાજી વાંકાણી ( ભાવસાર ) વરતેજવાળા જેએ તીર્થકમિટીની શરૂઆતથી આં સંસ્થામાં છે અને ભાઈ હંલીયંદ ઝગનાથ તણુસાવાળા લોજનથાળામાં છે તેમજ પેઢીનાં સૌ સ્ટાઇનાં આથ સહુકાર વગર પ્રગતિ થઈ શકે જ નહીં. મને આનંદ થાય છી કે જેમ તીર્થકમિટીનાં સૌ સહ્યોમાં એક દીલી એક વાક્યતા છી તેવી

સ્ટાઝમાં પણ છે. પ્રમાણીક સ્ટાઇથી જ આ સંસ્થાની પ્રગતીને વેગ મળ્યો છે.

તાલિધજ તીર્થમાં બાધુની લૈન ધર્મશાળામાં હું રહું છું. આ ધર્મશાળા એ તો સંસારનું ચિત્ર તાદૃષ્ય કરે છે. સંવત ૨૦૧૫માં મારા પ્રીત વર્ષ વનપ્રવેશ પ્રસંગે “અમરસાધના” પુસ્તક મારા સ્નેહી ભાઈશ્રી ઉત્તમચંદ હુરગોવીદાસ શાહ ક્ષાવનગરવાળાની સહાયથી પ્રસિદ્ધ થયું હતું. શ્રી તળાજા સંધસમસ્ત ત્થા સ્નેહીએ મુરખથીએનાં આર્થિર્વાદ પ્રાપ્ત થયા હતા, સ્નેહી ભાઈશ્રી બાધુભાઈ પરમાણુંદાસ તથા શ્રી રમણીકલાતલાઈ વીઠલદાસ તથા શ્રી ઉમેદચંદભાઈ રૂપચંદે મેળાવડો ચોળું અલિનંદન આપ્યા હતા.

આજે પછુમાં વરસે અગીયાર વરસથી તીર્થસેવાનું કામ ચાલુ છે. ઈંટ યજથી લોજનગૃહ, ધર્મશાળા, પગથીયા, સ્નાનગૃહ, આયંભીલ ભવન, સાધના મંદિર, શાનમંદિર વી. તીર્થઉદ્ઘારનાં કાર્યો થયા છે. અમારા લુલનમાં કોઈ જંળ વધી નથી અને કંગાળ બન્યા નથી. અમો બન્ને દંપતી સંતોષ પૂર્વક ધર્મધ્યાન પૂર્વક લુલન લુવાએ છીએ, અમારે કોઈ ધરાળ-ઉકાળની સાંસારીક ઉપાધી નથી. અમોએ ૪૦ વર્ષની ઉંમરથી ચતુર્થ વૃત ચહુણું કર્યું છે. “અમર સાધના” દુંધેય સિદ્ધ કરવા આ તાલિધજગિરિનાં શીખર સુધી અમર લુલન પણાંચસું છે, ને અંતિમ સમય સુધી દેવ-ગુરુ-ધર્મની શક્તાપૂર્વક અત્રેજ પુર્ણિતા પામે એવી અલિલાપા છે. મારા ધર્મપત્રિન પણ યાત્રાએમાં, સામયિક-પૂજામાં તથા શ્રાંતિજિન મહિલા મંડળમાં સેવા આપી આનંદપૂર્વક લુલન વિતાવી સંતોષપૂર્વક સાધના કરે છે. મારું સમસ્ત કુટુંબ કલ્યાણકમાં મારા લદુખંધુ દલીચંદનાં સાનિધ્યમાં

બીજપુર-ખાગલકોટ-ગુલખર્ગાં રાયચુરમાં-સાયકલનો ધંધી કરે છે અને સૌ સુખી છે, તેની અમારે કંઈ ઉપાધી નથી. મારા પૂજ્ય પિતાશ્રી સંવત ૨૦૦૪નાં ભાદરવા વહી દના બીજપુર ખાતે અવસાન પાખ્યાં હતા. મારા વડીલ લાઈ શ્રી પુરુષોત્તમદાસ દીયાળલાઈ ભાદરવા વહી ઉના રોજ પચ્છિગામ સુકામે અવસાન પામેલા, તેમજ મારા વડીલભાઈશ્રી પોપટલાલ પણ સં. ૨૦૧૦ના વૈશાખ સુદ દના રોજ પચ્છિગામ ખાતે અવસાન પામેલ; મારા પૂજ્ય માતુશ્રી ટબલબાઈ ૨૦૨૦ના આસો વહી ૧૪ દીપોત્સવી દીને સમાધીપૂર્વક અવસાન પાખ્યા હતા. તેમનાં અંતિમ દર્શને અમો અને બીજપુર જઈ એ માસ સાથે રહી આરાધના કરાવી આશિવોદ પ્રાપ્ત કરેલાં.

આ તીર્થમાં પણ લુવદ્યાની પ્રવૃત્તિ ચાલે છે. સંસ્થામાં પારેવાને જુવાર, કુતરાને રોટલા, ઉનાળામાં ગાયોને ધાસ, પાણીને. અવેડે મધ્યમવર્ગ રાહત, દર્દીઓને દવા. વીગેર કાચો થઈ રહ્યા છે. તીર્થકભિન્નાં સૌ સભ્ય સાહેબો મુરળ્યી શ્રી છાટાલાલલાઈ નાનચંદ તથા મુરળ્યી શ્રી વલલદાસલાઈ ગુલાબચંદ વીગેરની મારા પ્રત્યે અમીદાંશી છે. સંસ્થાનું સુકાન વિશ્વાસપૂર્વક પ્રગતી કરી રહ્યું છે. તળાણ સંધનો પણ સુંદર સહકાર છે. તીર્થકભિન્નાં પુન્યવંત પ્રમુખશ્રી સરળ સ્વભાવી આત્મા છે. લુવનનાં ધોયેમાં લુવદ્યા એ મુખ્ય લુવનમાં વણુયેલી ઢોંગી જોઇએ. લુવદ્યા વગરનું લુવન પણ સમાન છે. જ્યાં લુવદ્યા છે ત્યાં માનવતા છે. પરદ્યામાંથી સ્વદ્યા પ્રાપ્ત થતા આત્મપ્રાપ્તિ થાય છે. કરુણા, દ્વારા ને અનુકંપા એ માનવ લુવનની મહત્ત્વા છે. સર્વલુવ પ્રત્યે દ્વારા રાખવો એ સર્વે ધર્મોનો સાર છે. આ

આંગે એક કાંદુ અમર આત્મમંથનતું સાહર કરી આ  
 ‘અભયદાનનાં અનુભવો’ જે સૌ કોઈને પ્રેરણાત્મક છે તે  
 આત્મવંચનાનો હોષ ઠેણારી લઇ સમાજ સમક્ષ રણુ કરી  
 વીરમું છું. અને જગતનાં સર્વ જીવાત્માઓ સુખી થાયો—  
 જીવહિંસાથી બચો—અહિંસાથી જીવન દીપાવો તેવી લાવના  
 લાવું છું.

કીડીને કચરી રહ્યો આત્મ તુજ સમ હોય;  
 પુદ્ગલ લાવે ન નિરખે, આત્મ સ્વરૂપે જોય. ૧

કીડી કે કુંજર વિષે, આત્મ સરખો જણુાય;  
 કોઈ જીવ હુણ્યાય તો, હોષીત સરખો ગણુાય. ૨

હુણુશો જયાં સુધી તમે, હુણાવું પડશો જડૂર;  
 તેનો પાર આવે નહીં, ત્યાગો કર્મ એ કૂર. ૩

હુણે શિકારી જીવને, બહાદુર પોતે મનાય;  
 બહાદુરીની બડાઈમાં, એ પાપેજ હુણ્યાય. ૪

અહિંસા પરમોધર્મ જે, જગતમાં પસરી જય;  
 વહેતી નદીઓ રક્તાની, નાખુદ નક્કી થાય. ૫

### જ વ દ યા

પ્રેમનો પયગામ પાની, દ્વાને વિકસાવળે;  
 ઝુંગા જગતનાં પ્રાણીઓને, અભયદાન અપાવળો.

જીવદ્યા મંડળ જગતમાં, જગતું જીવં વિશ્રામ છે;  
 દાનો તીંદા વહાવળે, અહિંસા પરમો ધર્મ છે.

### ક મ ા પ ન ા

ક્ષમા કરજે સકળ જગનાં, જીવ અપરાધ મારા;  
 માગું સંવત્સરી દીને મન, વચન કાયાથી ઘારા.

પરતાઈને હવે વહાવું, દ્વા ભૃત પ્રેમધારા;  
 નાના મોટા સૌ જીવોની, યાચના ‘અમર’ ઘારા.

## ઉ પ સં હૃ ર

આ અભયદાનના અનુભવો જે મારા જીવન ચરિત્રનાં વધોંમાં જે અનુભવ્યા હતા તે માત્ર પરમાર્થ હેતુથી જીવદ્યાની ભાવનાને પ્રદિપ કરવા માટે જીવન-યાત્રાના સ્વરૂપમાં ટુંકાણુથી મારી બુદ્ધિ અનુસાર આદેખી ધ્વલપત્ર ઉપર પ્રકાશીત કર્યો છે. હું તો એક સામાન્ય માનવ છું, આખું જીવન નોકરી-યાત પણે સંસ્થાઓની સેવા કરી ઉપજીવન સામાન્યરીતે ચલાવી તેમાં મને જે જે તક સેવાની સાંપરી છે તેનો સદહિપયોગ ભન-વચન કાયાથી કર્યો છે.

જીવન સંસ્મરણો પોતેજ આદેખવા એ અધીતીત છે પરંતુ અનુભવોનું આદેખન એ સિવાય અશક્ય હતું. એમાં મારી ધર્ષણી તૃટીઓ, ગૌણું પણે રહી ગઈ હોય, વિશેષતા ઉપસાવી હોય તે માટે હું મિચ્છાળી ફુર્ઝંડ ધર્યું લડ્યા છું.

મારા બંધુઓ, ભત્રિજાઓ, કુટુંખાઓએ મને મારા સેવા-યજમાં નિવૃત્તિ આપી મારા શીરેથી કુટુંખની જવાબદારી ઉપાડી લઈ મને નિશ્ચિંત રાખ્યો છે. સંસ્થાઓએ મારામાં સંપૂર્ણ વિશ્વાસ મુકી મને સેવાકાર્યમાં ધર્ષણીજ સગવડતા આપી છે. વર્તમાન પત્રોના અધિપતિ સાહેઓએ મારા જેવા સામાન્ય લેખકનાં ગંધ-પંધ લખાણો બહુ પ્રેમપૂર્વક પ્રસિદ્ધ કરી મને આબારી બનાવ્યો છે. સૌ મિત્રોએ, મુરળ્ણીઓએ મને પોતાનો બનાવ્યો છે. એ સૌનો હું આ તક અંતઃકરણું પૂર્વક આલાર માની મારું હવે પછીનું જીવન-આરોગ્ય, સુખ-શાંતિ-મય, જીવદ્યાને પંથે, અધ્યાત્મ યોગ સાધનામાં પસાર થાય અને મારી શક્તિઓનો સહંયય થાય તેવી ભાવના પૂર્વક વીરમું છું. અં શાંતિઃ શાંતિઃ શાંતિઃ

લેખક

# જીવો ને જીવાડો

નાના	નાના	દેક્કાં,	પેહા	જગમારી	થાય;	
સતાવીએ	નહિં	રમતમાં	એ	પણું	જીવ	ગણ્યાય.
૩૬૨	હોયે	ધરમહીં,	પછીને	ન	મરાય;	
છાડી	દેવો	જીવતો,	એ	પણું	જીવ	ગણ્યાય
ચીલ્લી	પોપટ	પંખીને,	પીંજર	નહિં	પુરાય;	
કંકળે	આત્મા	તેઢનો,	એ	પણું	જીવ	ગણ્યાય
કુતરા	બિલ્લી	પ્રાણીને,	કદી	ન	માર	મરાય;
પાલન	કરણું	ઓહનું,	એ	પણું	જીવ	ગણ્યાય.
સસલા	મૃગલાં	વનમહીં,	સુએ	ચરવા	નાય;	
શિકાર	નહિં	કરવો	કદી,	એ	પણું	જીવ ગણ્યાય.
વાધ	વહુ	વન	વિચરે,	સાય	રહે	ભોં માય;
નહિં	હણુવા	એ	પ્રાણીને,	એ	પણું	જીવ ગણ્યાય.
વાંદર	ફરતો	ઝોરડે,	કદી	ન	ધાથી	મરાય;
મુંગા	પ્રાણી	અખુત છે,	છતાં	એ	જીવ	ગણ્યાય.
માય	બેંસ	બકરી	કદી,	ધરમાંથી	ન	કઢાય;
એ	તો	સુખનાં	સાધનો,	છતાં	એ	જીવ ગણ્યાય.
ભૂષ્યા	તરસ્યા	જીવને.	કદી	નહિં	૦૪	રખાય;
હાય	ઝુરી	એ	પ્રાણીની,	કારણું	જીવ	ગણ્યાય.
દ્વા	રાખવી	જીવ	પર,	હિંસા	કદી	ન કરાય;
“અમર”	અહિંસાથી	થશે,	સુખ	ને	દુઃખો	નાય. ૧૦

## જીવદ્યાના ભાગીડાર

૪	છરી ધરે પ્રાણી ઉપર, છોડાવવા જે જાય;
૫	અભયદાન જીવને દીયે, પહેલું પુન્ય ગણ્યાય.
૬	ખ્રે મરતા પ્રાણીયો, તરસે જે રિખાય;
૭	ભુખ તરસ હુઃખ દાળતા, બીજું પુન્ય ગણ્યાય.
૮	કુદરતના સંકટ મહીં, જીવો જેણ કુચાય;
૯	મહે કરે સંકટ મહીં, ત્રીજું પુન્ય ગણ્યાય.
૧૦	નિર્ઝાનની રક્ષા કરે, હુઃખીઓને દે સહાય;
૧૧	પ્રેમ ધરે જીવો ઉપર, ચોથું પુન્ય ગણ્યાય.
૧૨	પરખ બંધાવે તાપમાં, ચચ્છ દે ચચુતરામાંય;
૧૩	ધર્મશાળા બંધાવતા, પાંચમું પુન્ય ગણ્યાય.
૧૪	લુલા અંધા જરીએને, નિરાશીત જે હોય;
૧૫	ગુપ્તદાન હેતાં થકી, છું પુન્ય ગણ્યાય.
૧૬	લક્ષ્મી પાભ્યા હોય તો, લોલી નવ થવાય;
૧૭	દાન કરો મમતા તજુ, સાતમું પુન્ય ગણ્યાય.
૧૮	જીવદ્યાનાં કાર્યમાં, તન-મન-ધન દ્વો સહાય;
૧૯	મહિમા અભયદાનનો, જગમાં અજોડ ગણ્યાય.
૨૦	ધર્મ થકી ધન સંપર્જને, પાપ થકી હુઃખ થાય;
૨૧	વાવો જેણું ક્ષેત્રમાં, તેવા ઇળ લણ્યાય.
૨૨	પરોપકાર કરતાં થકા, જન્યા જે જગમાંય;
૨૩	ધન્ય જીવન છે એહનાં, 'અમર' પદ સધાય ૧૦

વડીલ ભાઈશ્રી,



તમારા આત્માને હંમેશા અમોદે  
તમોને ગમે તેવી સ્થિતિમાં સુખ અને  
સંતોષ માણું તિહાલ્યા છે. ધર્મ અને  
શાસનમાં જીવનના અંત સુધી તમારા  
કાર્યની સૌરલ પ્રસરતી રહે તે જોવાની  
હંમેશા અમારી ભાવના છે.

ખાજપુર

લઘુધંધુ

(કર્ણાટક)

દલીધંદ એમ. શાહ

તા. ૧૨-૮-૬૩

સાયકલ મર્યાન્ટ

જનમસં. ૧૯૭૭ પદ્ધેગામ

## અહિંસા

અહિંસા અહિંસા અહિંસા જગાવો;  
મહાવીરની આજ્ઞાને દીકે વસાવો-એ ટેક

જીવહિંસા કોઠ કરશો નહિં,  
કોઠ જીવોને હંખસો નહિં.  
જીવો અનાથ ગરીબ પશુના લન બચાવો. અહિંસા ૧

જીવો તમે ને જીવવા ધો;  
સુખ આપીને સુખ દીઓ.  
જીવો જગતનાં જીવનું ચાહે તેને જીવાડો. અહિંસા ૨

દ્વારા રાખી દીનને આપો,  
કુઝી જીવોનાં કુઝ કાપો.  
શુભાશિષ એ જીવોનાં લઈ જીવન અજ્ઞાળો. અહિંસા ૩

જીવદ્યાદીન જગમાં પ્રગટો,  
જીવદ્યાની જ્યેતને જગાવો,  
'અમર' અહિંસા દ્વારા જગમાં ફસ્કાવો. અહિંસા ૪

ભાવનગર તા. ૮-૮-૫૩

માનનીય વડાપ્રધાન સાહેબ,

સૌરાષ્ટ્ર રાજ્ય

રાજકોટ

સંવિનય,

આજે 'ભાવનગર સમાચાર' માં સિંહ સિંહણો અને તેના ખ્યાતાની ના. સૌરાષ્ટ્ર સરકારે ગીરના વિસ્તારમાં સૌરાષ્ટ્રના જગતી પશુઓ અને જગતી પક્ષીઓના સંરક્ષણ ધારા ૧૯૫૮ તથી શિકાર કરવાની મનાદ કરી છે, આ સમાચારથી અત્યંત આનંદ થયો છે. અને આવા માનવતા મુક્ત અહિંસાની પ્રતિકા વર્ધિક ઇરમાનથી આપશી તથા ના. સૌરાષ્ટ્ર સરકારને હાર્દિક અલિનંદન પાછવું છું,

૧૫ ઓગષ્ટે જ્યારે ભારત સ્વતંત્ર થયું છે, ત્યારે ભારતમાં વસતા તમામ માનવો-પશુઓ-પંખીઓ પણ સ્વતંત્ર થયા છે. પરદેશી શાસનમાં આ પશુઓએ પણ પોતાના મુંગે મોઢે બલિદાન આપ્યા છે. કરોડો ગાયો-ભંસો-ખળદો આદી માનવજીવનના સાથી-દારો કર્તલ થઈ ગયા છે, અનેક પ્રાણીઓ કુર શિકારનો ભોગ અન્યા છે.

ભારતની આજાદી આધ્યાત્મિક શક્તિથી પ્રાપ્ત થઈ છે, અહિંસા-સત્ય-પ્રેમ-સંયમ અને તપ તેનાં સાધનો હતા. એ પ્રાપ્ત થયા પણી ભારતમાં અહિંસાનું શાસન સ્થપાવું જોઈએ, રક્તપાત બંધ થવો જોઈએ અને સાત્વિક આધ્યાત્મિક રીતે આપણું અહિંસા-સત્ય-ન્યાય-નિતીના પંથે બંધારણ હોવું જોઈએ એ જ સાચું સ્વરાજ્ય છે.

જ્યારે હિંદુસરકાર તરફથી હિંસાના એક પણી એક ઇરમાનો બહાર પડતા જય છે. પોપટ અને વડવાંગળાને ઇણકુલનો વિનાશ

કરવાના ખડાને તેને મરાવી નાખવા એ આના અને દોઢ આનો આપવાનું જાહેર થયું છે. તે સિવાય પશુધનની કતલ ઉપર ખાસ પ્રતિબધ આવ્યો નથી. આપણા સ્વરાજ્યનું સ્વાધિનયદ્વારા ગાય છે, તેની રક્ષા માટે હજુ કાઈ ખાસ થયું નથી, આપણી માનવતા ને બદલે સ્વાર્થીભાવનાને પ્રગટ કરતી આત્મા હિંસાઓ ચાલુ રાખવામાં આવે છે, પરિણામે જનતામાં કડોરતા, નિર્દ્યતા આદિ ભાવો પ્રબળ થાય છે તેનું પરિણામ જેમ પૂજ્ય વાપુજ્યએ કંદું હતું તેમ 'જે માકડ મારે તે માખસ મારે' તેવું પરિણામ આવે.

દ્વા ભાવના ડેળવ્યા સિવાય અહિંસાની જર્યોતિ પ્રગટશે નહિં. અને ત્યાં સુધી માનવતા સુખ-દ્રાર્થિત આનંદ પ્રાપ્ત થઈ શકશે નહિં આ રીતે અહિંસાના સાંનાયમાં પાશ્ચિમાત્ય હિંસાઓ જ્યારે ચાલુ છે ત્યારે આપણા સૈરાષ્ટ્ર રાજ્યમાં એક પછી એક કાયદાઓ અહિંસાની ભાવનાને પોષણ મળે તેવા થાય છે, તે સૈરાષ્ટ્રની શાન વધારવામાં અયંત ઉપરોગી થશે.

આપણા સૈરાષ્ટ્રમાં ગોવધયંધી-પશુધન રક્ષણ વિગેરે કાયદાઓ થયા છે અને પશુ ઉછેર માટે ખાસ ખાતુ ચલાવવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી આપણા પ્રહેશમાંથી નિકાશ થવાની દ્શ્ટ રહેશે ત્યાં સુધી આપણો વિકાસ અપૂર્ણ રહેશે. આપણું સુધારેલું પશુધન સૈરાષ્ટ્ર બહાર જર્દ મુંબઈ આદિ સ્થળો કતલ થઈ જવાનું. થોડા વખત પહેલા છાપામાં વાંચ્યુ હતું કે, પાકીતાણા ડીસ્ટ્રીક્ટમાંથી જાતિવંત બેસો સૈરાષ્ટ્ર બહાર નિકાસ થાય છે, આનું પરિણામ આપણને નુકશાનમાં આવવા સંભવ છે.

આપણીની દીર્ઘદિષ્ટ સૈરાષ્ટ્રને નંદનવન બનાવવાની ભાવનામાં સૈરાષ્ટ્રના ચાર પાયા ગાય-ગોવાળ-એતી અને એકત્રનું રક્ષણ

કરી મજબૂત કરવામાં આવશે તો ભારતમાં સૈરાષ્ટ્ર એક કલાગી-  
શાખા શોભશે.

ભારતવર્ષમાં સર્વ માનવો અને સર્વ પણ પંખીઓ સ્વતંત્રતાનો  
આનંદ અને સુખ લોગવવા ભાગ્યશાળી થાય, લોહીનું ટીપું પાંખ  
સિવાય મેળવેલી આજાદી લોહીની સરિતાઓથી નહિં પણ અહિંસાથી  
અખંડ રહે, તેવી ભાવના સ્વાતંત્ર્ય હીને ભાવવા સાથે ફરી આપણીને  
તથા આપણી માનનિય સૈરાષ્ટ્ર સરકારને અલિનંદન આપી વીરમું છું.

દી. આપનો  
અમરચંદ માવજી શાહ

મહુવા તા. ૧૬-૧૦-૫૧  
લાઈશ્રી, અમરચંદલાઈ

ધર્મનું રક્ષણ કાયદાથી નથી થતું, પ્રત્યેક માનવીનો શો ધર્મ  
છે, એ જ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કાયદો શું કરી શક-  
વાનો છે? જે મેં પોતે જ્યેયું છે કે ગાયને આપણે ડેવી ફૂર રીતે  
સાચવીએ છીએ? એવા હિંદુ ધરો મેં ધણા જોયા છે. એટલે આવી  
ફૂરતા કરવા કરતાં બહેતર છે કે, એને એ દુઃખમાંથી સુક્તા કરવી.  
અલઘત ગૌરક્ષાથી જ દેશ ઉંચો આવે તેમ છે. એટલા મારે તો  
પૂ. બાપુજીએ ફેટલાયને ગાયનું જ દૂધ ધીનું વૃત લેવગાવયું છે કે  
ક્રોઈ રીતે ગાયનું રક્ષણ થાય, પણ આપણે રક્ષણ ક્યાં સુધી કરીએ  
છીએ? જ્યાં સુધી એ બિચારી આપણને દૂધ આપે ત્યાં સુધી.  
આપણા સ્વાર્થને મારે રક્ષણ કરીએ છીએ કે આપણો ધર્મ છે મારે?  
એટલે બાપુ ફહેતા કે ગૌરક્ષા એ તો પ્રત્યેક માણુસનો ધર્મ હોવો  
જોઈએ.

મનુષહેન ગાંધી

પોરાક અને એતીવાડી ખાતુ (સૌરાષ્ટ્ર રાજ્ય)

રાજકોટ તા. ૩-૩-૫૦

શ્રી અમરચંહ માવળ થાકુ

જથિંહ સાથ આપનો માનનીય વડાપ્રધાન શ્રીને સંઝોધા-  
યેલો તા. ૧-૬-૫૦ના પત્રના જવાબમાં જણાવવાનું જે આપે  
“પશુપાલન” માટે જે જે સુચનાઓ કરી છી તે બદલ સરકાર  
આપનો સાદર આખાર માને છી.

-મદદનીશ મંત્રી

શીનાન્સ મીનીસ્ટર (ઇન્ડીયા)

ન્યુ ફીલ્ડ્સ તા. ૬-૩-૬૩

ભાઈશ્રી અમરચંહ

“તમારો તા. ૧૬૩૫-૩૬માં ડેંથી-  
વલીમાં દેાકમાન્ય ગૌથાળાની મારી મુલાકાત યાદ કરી તમે  
ગોસંવર્ધન અંગેના તમારો વિચારો તમે હશ્યોંયા છી. આ  
પાયાની વાત છી અને આપણી એતી સાથે ‘ગોપાલન’ ક્યાં  
સિવાય આપણે એ બન્ને ક્ષેત્રે પ્રગતી કરી શકવાનાં નથી.

આ બાધતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો હુંવે જાત્રત  
ઘનતા જથ છી”

-મોરારજી દેશાઈ

# અમ્ર સ્વાવલંબન અને

ભારત-ભાગ્ય નિર્માતા માનનિય પુજા  
લાલણહાડુર શાસ્ક્રીળુએ ભારતીય સંસ્કૃતિ  
જવાન' અને 'જય કીસાન'નું સૂત્ર  
નવનિર્માણ કરવાનું મહાન યત્થસ્વી કા  
જવાનો આજાહીનું રક્ષણું કરે, કીસાનો ર  
રક્ષણું કરે. પરહેશથી અનાજ આવે અને  
અજ મળે એ પરાવલંબન-પરાધિન દર  
નાખવા અને સ્વાવલંબન પ્રાપ્ત કરવા ભાર  
છી, તે ભારતની સ્વાધિનતાનો સૂર્ય-સો  
થવાનાં પગરણું છી. વરસોથી હું લખતો  
ઘેરૂત-ગાય અને ગોવાળ આ ચાર પાયાથી  
મંજખૂત થશે. ભારતની સ્વાધિનતાનું  
પશુઓ દ્વારા સલામત બનશે. ગાયો-લેંસો  
ફ્લાધ, ધી, છાશ, માખણું આદિ તથા ખા  
ખળાહો દ્વારા ઘેતી થશે. પરંતુ આ બાં  
અઠાર વરસે સન્મતિ સૂર્જી છી અને ભા  
શાસ્ક્રીળુની દરમ્યાનગિરીથા ચોથા પંચ  
કરવામાં આવેલ ફેરફારોમાં ઝા. ૬/ ૩  
કાલખાના, ઝા. ૬૮/ લાખના મધ્યમ કારણ  
લાખના નાના કદના ૧૨૮ કાલખાના,  
નવી મટન મારકેટ અને ૨૫૦ લાખના હુ

